

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૧૦ જુલાઈ ૨૦૨૩, સોમવાર
વિક્રમ સંવત ૨૦૭૯, અષાઢ વદ આઠમ

વર્ષ : ૧૪
અંક : ૩૩૦

તંત્રી : પટેલ સુરેશ રમણલાલ
અમદાવાદ

કિંમત : રૂ. ૨.૦૦
પાના : ૮

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

જમ્મુ-કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ

દિલ્હી-એનસીઆરમાં 41 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વરસાદે સમગ્ર સિસ્ટમને ખોરવી નાખી



દિલ્હીના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા

ચોમાસાની સીઝનના કુલ વરસાદના ૧૫% વરસાદ માત્ર ૧૨ કલાકમાં થયો. પાણી ભરાવાના કારણે લોકો ભારે પરેશાન થયા હતા. આજે દિલ્હીના તમામ મંત્રીઓ અને મેયર સમસ્ત્યાવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરશે. તમામ વિભાગના અધિકારીઓને રવિવારની રજા રદ કરીને મેદાનમાં ઉતરવા સૂચના આપવામાં આવી છે. શ્રીનિવાસપુરીમાં શાળાની દિવાલ ધરાશાયી થઈ છે. દિલ્હીને અડીને આવેલ ગુડગાંવ અને નજીકના અંડરપાસ પણ પાણીમાં ડૂબી ગયા છે. હવામાન વિભાગે દિલ્હીમાં મધ્યમ વરસાદની આગાહી કરતા 'ચલો એલર્ટ' જાહેર કર્યું છે. આગામી બે દિવસ સતત વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો, રિષ, લોધી રોડ અને દિલ્હી યુનિવર્સિટીના હવામાન કેન્દ્રો પર અલુકમે ૧૩૪.૫ મીમી, ૧૨૩.૪ મીમી અને ૧૧૮ મીમી વરસાદ નોંધવામાં આવ્યો હતો.

1 નવી દિલ્હી, તા.૯ । ચોમાસાની શરુઆત થતા જ અનેક રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉત્તર પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. એક તરફ દિલ્હીમાં વરસાદે ૪૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થયો છે. આ સાથે ગુજરાતના કચ્છ ભૂજ, સહિતના અનેક જિલ્લામાં ભારે વરસાદ છે.



રસ્તાઓ અને અંડરપાસ સુધી પાણી ભરાયા છે. આ પછી સીએમ અરવિંદ કેજરીવાલે પરિસ્થિતિને સંભાળવા માટે મોટો નિર્ણય લીધો છે. રાજધાની દિલ્હીમાં રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે સમાપ્ત થયેલા ૨૪ કલાકના ગાળામાં ૧૫૩ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૮૮૨ થી, આ વરસાદ અહીં જુલાઈમાં એક જ દિવસમાં પડેલો સૌથી વધુ વરસાદ છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી વિક્ષેપ અને ચોમાસાના પવનોને કારણે ઉત્તર

પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થયો હતો અને દિલ્હીમાં સિઝનનો પ્રથમ 'અતિ ભારે વરસાદ' નોંધાયો હતો. મુશળધાર વરસાદને કારણે જ્યારે ૪૧ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો ત્યારે દિલ્હી ક્યાંક 'ટાપુ' તો ક્યાંક 'નદી' જેવું લાગતું હતું. શેરીઓથી લઈને રસ્તાઓ, બજારો, હોસ્પિટલો અને અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી પ્રભાવિત થયા હતા. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રતિકૂળ સંજોગોમાં સ્થિતિને સંભાળવા માટે મોટો નિર્ણય લીધો છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને તાત્કાલિક રાહત આપવા માટે રવિવારની રજા રદ કરીને સ્થળ પર નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હીના તમામ મંત્રીઓ અને મેયર સમસ્ત્યાવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે. તમામ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને ફિલ્ડમાં રહીને વ્યવસ્થા સુધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

હિમાચલમાં ભયંકર વરસાદ અનેક જગ્યાએ પુરની સ્થિતિ

હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. કેટલીય જગ્યાએથી લેન્ડસ્લાઈડના વીડિયો સામે આવી રહ્યા છે. નદીઓ ગાંડીતૂર થઈ છે. આ દરમિયાન રવિવારે કુલ્લૂની નજીક બ્યાસ નદીમાં એક કાર તણાઈ ગઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કાર નદીમાં તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ભારત મોસમ વિજ્ઞાન વિભાગે આગામી ૪૮ કલાક માટે હિમાચલ પ્રદેશના સાત જિલ્લા માટે રેડ એલર્ટ, ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને લાહુલ અને સ્પીતિ જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કર્યા છે. મોસમ એજન્સીએ રાજ્યમાં ભૂસ્ખલન અને અચાનક પુરનું એલર્ટ જાહેર કર્યું છે. ચંબા, કાંગડા, કુલ્લૂ,

મંડી, ઉના, હમીરપુર અને ઊનાપુર જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના મોટા ભાગની જગ્યા પર વરસાદ થશે. તો વળી શિમલા, સોન અને સિરમોર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMDના એક અધિકારીએ કહ્યું કે, આ રાજ્ય સરકાર સાથે પોતાના પૂર્વાનુમાન શેર કર્યું છે.

પાણીની આવકને કારણે વાસણા બેરેજના નવ દરવાજા ખોલાયા

1 અમદાવાદ, તા.૯ । અમદાવાદના વાતાવરણમાં પવલો આવ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની આગાહી દરમિયાન અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. અહીં વાસણા બેરેજના ૯ દરવાજા ખોલાતા ખેડા અને માતર તાલુકાના કાંઠાના ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આર્મીમાં હવે ૫૦% અગ્નિવીર પરમેનન્ટ થઈ શકે મોટાભાગના અગ્નિવીરોને આર્મીમાં એન્ટ્રી આપવા તૈયારી

1 નવી દિલ્હી, તા.૯ । ઈન્ડિયન આર્મી ઈચ્છે છે કે અગ્નિવીરોમાંથી ૪ વર્ષ પછી લગભગ ૫૦ ટકા અગ્નિવીરોને પરમેનન્ટ કરવા જોઈએ. જોકે હજુ અગ્નિપથ સ્કિમ અંતર્ગત એવો નિયમ છે કે માત્ર ૨૫ ટકા સૈનિકો જ પરમેનન્ટ આર્મીમાં જોડાઈ શકે છે. આ વિકલ્પમાં ફેરફાર થઈ સંખ્યા વધારવા માગ પણ કરાઈ રહી છે. સેનાએ આ મુદ્દે સરકાર સામે પોતાની માગ રજૂ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા પણ આ સંબંધે ફાઈલ આગળ વધારવામાં આવી હતી પરંતુ આર્મીએ આ માગનો અસ્વીકાર કર્યો હતો. હવે ફરીથી સેના આ મુદ્દે ટિપ્પણી કરવા માગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના ઈચ્છે છે કે અગ્નિવીરોની દરેક બેચમાંથી લગભગ ૫૦ ટકા અગ્નિવીરોને પરમેનન્ટ કરાવે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે પહેલા જ્યારે સૈનિકોની ભરતી થતી હતી તેમાં જે સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યું હતું તે જ અગ્નિવીરો માટે રાખવામાં આવ્યું છે. અમે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઈઝ કરવા માગતા નથી. ૫૦ ટકા અગ્નિવીરોને પરમેનન્ટ કરવા સિવાય આર્મીએ સરકાર સામે એ પણ પ્રસ્તાવ રાખ્યો છે કે અગ્નિવીરોની ભરતી ઝડપી બનાવાય. એટલે કે એક વર્ષમાં ભરતી માટે જે નંબર નક્કી કરાયો હતો તેમાં વધારો કરાય. જેના કારણે આર્મીમાં સૈનિકોની જે અછત છે વેકેન્સી છે તેને પૂરી કરી શકાય. કોવિડના કારણે ૨ વર્ષ સુધી આર્મીમાં ભરતી નહોતી કરવામાં આવી. જ્યારે આર્મી પહેલા દર વર્ષે લગભગ ૮૦ હજાર સૈનિકોની ભરતી થતી હતી. આનાથી સેનાથી નિવૃત્ત થયેલા અને સેનામાં ભરતી થયેલા સૈનિકોની સંખ્યામાં બેલેન્સ બનેલું રહેતું હતું. ગત વર્ષે જ્યારે અગ્નિપથ સ્કીમ હેઠળ અગ્નિવીરોની ભરતી કરાઈ તો પહેલા વર્ષે ૪૦ હજાર અગ્નિવીરોની ભરતી થઈ હતી. ત્યારપછી ધીરે ધીરે આ નંબર વધતો ગયો અને વર્ષ ૨૦૨૨ માં સુધી કુલ ૧ લાખ ૭૫ હજાર અગ્નિવીરોની ભરતી સેનામાં થવાની છે.

આગામી ૨૪ કલાક ગુજરાત રાજ્ય પર મેઘ મહેર રહેશે

1 અમદાવાદ, તા.૯ । આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેવાની આગાહી છે, હવામાન વિભાગે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી થવાની સંભાવના વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, ૨૪ કલાકમાં સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે. આ સાથે કેટલાક ભાગોમાં ભારેથી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

SAKSHAM
LEARN TOGETHER GROW FASTER

ENGLISH / ગુજરાતી માધ્યમ

CITY TOPPER
(ANAND / KHEDA)

ASTHA SINGH
659/720
NEET 2023

RE-NEET | 12TH PASS | DROPPER BATCH

ADMISSION OPEN

+91-9054460449 | NR. D'MART, V VNAGAR

રેલવે મંત્રી દ્વારા ફોટા ટ્વિટર પર શેર કરવામાં આવ્યા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ભગવા રંગમાં જોવા મળશે

1 નવી દિલ્હી, તા.૯ । દેશમાં એક બાદ એક વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કરવામાં આવ્યું રહ્યું છે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના બે મોટા શહેરોને એક બીજા સાથે જોડવા માટે અને મુસાફરો ટૂંક સમયમાં પોતાના મુકામે પહોંચી જાય છે. વંદેભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી લઈને અત્યારસુધી આ ટ્રેનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. લોકો દ્વારા આપવામાં આવતા ફીડ બેકને ધ્યાને રાખીને ટ્રેનમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. ત્યારે હવે વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. વંદે ભારત ટ્રેન રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવ દ્વારા ભગવા કલરની ટ્રેનના ફોટા ટ્વિટર પર શેર કરવામાં આવ્યા છે. ભગવા કલરની વંદેભારત ટ્રેન હજુ સુધી ચાલુ થઈ નથી પરંતુ અત્યારે ચેન્નાઈના ઈંટીગ્રલ કોચ ફેક્ટરીમાં આ ભગવા રંગની ટ્રેનોને રાખવામાં આવી છે. અહીં વંદેભારત ટ્રેનને બનાવવામાં આવે છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, વંદે ભારત એક્સપ્રેસના કુલ ૨૫ રેક નિર્ધારિત માર્ગો પર ટોડી રહ્યા છે અને જ્યારે બે રેકને રિઝર્વ રાખવામાં આવ્યા છે. ૨૮માં રેકમાં પરિક્ષણના ભાગરૂપે ટ્રેનના રંગને બદલવામાં આવ્યો છે.

ફ્લોપ જઈ રહેલા પૃથ્વી શોનું વિવાદિત નિવેદન એતેશ્વર પુજારા મારી જેવી બેટિંગ નથી કરી શકતો

1 નવી દિલ્હી, તા.૯ । ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમી ચુકેલા પૃથ્વી શોને છેલ્લા કેટલાય ભારતીય ટીમમાં ચાન્સ આપવામાં આવી રહ્યો નથી. IPL ૨૦૨૩માં પણ શો સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. તેને સીઝનની મધ્યમાં દિલ્હી કેપિટલ્સે બહાર કરી દીધો હતો. જો કેપિટલ્સ તેને આવનારી સિઝન

સમાચાર પત્ર છે લોકતંત્રનો ચૌથો સ્તંભ અને પ્રાણ,
જે કરે છે એક લોકતંત્રનો નિર્માણ !

CHANNEL NINE NETWORK GUJARAT
◆ ન્યૂઝ પેપર, ◆ ન્યૂઝ ચેનલ, ◆ ન્યૂઝ વેબસાઈટ

આજે જ **cnngujarat.co.in** વેબસાઈટ ઉપર
વિઝીટ કરો અને જોડાઈ જાઓ સમાચારની દુનિયા સાથે...

CNN
CHANNEL NINE NETWORK GUJARAT
Gujarati Daily News Paper

LIVE
cnngujarat.co.in

વર્લ્ડ કપ અંગે પાકિસ્તાનના મંત્રીએ આપ્યું નિવેદન પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ માટે ભારત આવશે નહીં



ઈસ્લામાબાદ, તા.૯ |

વર્લ્ડ કપની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. બધી જ ટીમોએ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દીધી છે. યજમાન ટીમ પણ તૈયારીઓમાં કોઈ કચાશ ના રહી જાય તેની કાળજી લઈ રહી છે. પરંતુ પાકિસ્તાન છે કે તેની નોટંકી હજી પણ ચાલુ છે. આપણો પાડોશી દેશ હજી પણ વાઘવાટોમાં અટવાયેલો છે. ક્યારેક પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો એલફેલ બોલે છે ક્યારેક બોર્ડના અધિકારીઓ વાંકું બોલે છે. આ વખતે તો પાકિસ્તાનના રમતગમત મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે. રમતગમત મંત્રી અહેસાન મજારીએ કહ્યું કે, જો ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે. પાકિસ્તાની ટીમને ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત આવવું જોઈએ કે નહીં તે નિર્ણય લેવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક સમિતિ બનાવી છે. ૪૧ વર્ષીય અહેસાન મજારી આ ટીમનો ભાગ છે. તેમનું કહેવું છે કે, એશિયા કપ દરમિયાન ભારત પોતાની મેચો ન્યૂટ્રલ મેદાન પર રમવાની માગ કરતી હોય તો અમે પણ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ દરમિયાન અમારી મેચો કોઈ ન્યૂટ્રલ મેદાન પર રમવાની માગ કરીએ છીએ. અહેસાન-ઉર-રહમાન-મજારીએ કહ્યું કે, "પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મારા મંત્રાલય હેઠળ આવે છે અને આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે, ભારત એશિયા કપ દરમિયાન જે માગ કરી રહ્યું છે તેવી જ માગ પાકિસ્તાન પણ વર્લ્ડ કપ દરમિયાન કરશે." ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકાર દ્વારા રચવામાં આવેલી આ સમિતિના અધ્યક્ષ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટે જરૂરી છે અને તેમાં અન્ય ૧૧ મંત્રીઓ પણ સામેલ છે. આ સમિતિ પોતાનો રિપોર્ટ વડાપ્રધાનને સોંપશે અને અંતિમ નિર્ણય તેમનો હશે.

કેપ્ટન કૌરની તોફાની અડધી સદી પ્રથમ ટીર૦માં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ ટીમને પરાજય આપ્યો ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી

ટાકા, તા.૯ |

ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટીર૦ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. બાંગ્લાદેશની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય મહિલા ટીમ સામે ૧૧૫ રનનો લક્ષ્ય રાખ્યો હતો, જેને હરમનપ્રીત કૌરની ટીમે ૨૨ બોલ બાકી રહેતા માત્ર ત્રણ વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. ભારતીય મહિલા ટીમ તરફથી કેપ્ટન હરમનપ્રીતે માત્ર ૩૫ બોલમાં અણનમ ૫૪ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે છ ચોગા અને બે સિક્સ ફટકારી હતી. તે સ્ટાર ઓપનર સ્મૃતિ મંથાનાએ ૩૪ બોલમાં પાંચ ચોગાની મદદથી ૩૮ રન બનાવ્યા હતા.



અણનમ રહી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશ મહિલા ટીમની શરૂઆત ધીમી રી રી હતી. પાંચમી ઓવરમાં ૨૭ રનના સ્કોર પર પ્રથમ વિકેટ પડી હતી. શમીમા સુલ્તાન ૧૨ બોલમાં બે ચોગાની મદદથી ૧૭ રન બનાવી આઉટ થઈ હતી. તેના આઉટ થયા બાદ રન ગતિ પર બ્રેક લાગી હતી. બાંગ્લાદેશે ૯મી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી હતી. શાથી રાની ૨૬ બોલમાં ચાર ચોગાની મદદથી ૨૨ રન બનાવી આઉટ થઈ હતી. તો ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલી સોબાનાએ ૩૩ બોલમાં ૨૩ રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટર નિગાર સુલ્તાન બે રન બનાવી પેવેલિયન પરત ફરી હતી.

ટેસ્ટમાં કંગાળ ફોર્મના કારણે દિગ્ગજની તીખી પ્રતિક્રિયા વિરાટ કોહલી હવે FAB-4 ક્લબથી બહાર ફેંકાયો ટેસ્ટ મેચમાં સતત ખરાબ પ્રદર્શનના : આકાશ ચોપરા

મુંબઈ, તા.૯ |

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં એકતરફી હારનો સામનો કરીને ટીમ ઈન્ડિયા ઘરે પરત ફરી છે. તેવામાં હવે વિરાટ કોહલીના ટેસ્ટમાં કંગાળ પ્રદર્શનના કારણે ફેન્સ નિરાશ થઈ ગયા હતા. એક સમયે એવો હતો કે આ ખેલાડી એક એન્ડથી મેચ ચલાવતો અને ભારત મેચ જીતી જતું હતું. પરંતુ હવે ટેસ્ટમાં સતત ફ્લોપ રહેતા કોહલી પર કટાક્ષ કરતા આકાશ ચોપરાએ મોટી વાત કહી દીધી છે. પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું કે પહેલા જે ટેસ્ટ વર્લ્ડ ક્રિકેટની FAB-4 ક્લબ હતી એમાંથી વિરાટ કોહલી બહાર ફેંકાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આ ક્લબમાં વિરાટ કોહલી, જો રૂટ, કેન વિલિયમ્સન અને સ્ટીવ સ્મિથનો સમાવેશ થતો હતો. પરંતુ હવે આકાશે વધુમાં કહ્યું કે આ FAB-3 ક્લબ બની ગઈ છે અને કોહલી આનાથી બહાર ફેંકાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, જો રૂટ અને કેન વિલિયમ્સનને તેની શાનદાર બેટિંગના કારણે FAB-4 ક્લબમાં સામેલ કરાયા હતા. આને ચાર ખેલાડીઓનું રાખવામાં આવ્યું હતું કારણે તેઓ આખા વિશ્વમાં જઈને



કોઈપણ મેદાન હોય જોરદાર રન કરતા હતા. વર્લ્ડ ક્રિકેટમાં તેમના નામથી બોલ્સ ગભરાઈ જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ કોહલીએ પોતાની લય ટેસ્ટ ક્રિકેટમાં ગુમાવી દીધી છે. એનું સીધું પરિણામ એ આવ્યું કે ફેન્સ નિરાશ થવા લાગ્યા અને ભારતની વિનિંગ ટકાવારી ઘટવા લાગી. આકાશ ચોપરાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર વાતચીત કરતા જણાવ્યું કે હવે કોહલી ખરાબ ફોર્મમાં છે. અત્યારે વર્લ્ડ ક્રિકેટમાં હજુ-જુ જેવું કંઈ રહ્યું જ નથી. કોહલી આ ક્લબની તો કચાવ જાય ત્યાં ફેંકાઈ ગયો છે. અત્યારે આમાં હવે FAB-3 જ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આકાશ ચોપરાના આ નિવેદન પછી હોબાળો મચી ગયો છે.

ન્યુઝ બોક્ષ

૧૩ વર્ષના સગીરનો ભોગ લેનાર ડમ્પર ચાલકની અટકાયત કરાઈ

અમદાવાદ, તા.૯ |

શહેરના અમરાઈવાડી પાસે થયેલા અકસ્માત મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે. તો બીજી તરફ ડમ્પરના માલિક જશુ ઓડ પરિવાર સાથે ફરાર થયો છે. મહત્વનું છે કે, સ્વસ્તિક ચાર રસ્તા પાસે ગત સાંજે વેચા પારસ નંદકિશોર નામના ૧૩ વર્ષના બાળકનું અકસ્માતે મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ ઉદ્ધેરચાલા ટોળાએ ઉધરને આગ લગાવી દીધી હતી. જે ગુનામાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આઈપીસીની કલમ ૩૦૪ હેઠળ ગુનો નોંધી વાહન ચાલકની ધરપકડ કરી છે. તો તેના ફરાર માલિકની શોધખોળ હાથ ધરી છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં એસીપી કક્ષાના અધિકારી તથા સમગ્ર ઝોનના પોલીસ કર્મીઓને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમી નહીં.

મહિલા કોન્સ્ટેબલ મધ્ય પ્રદેશના નીમય પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા

વડોદરા, તા.૯ |

શહેરમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી હતી. સાવલી તાલુકામાં આવેલાં દેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું ગયા શુક્રવારના રોજ અપહરણ થયું હતું. હવે આ મહિલા કોન્સ્ટેબલ શનિવારે મધ્ય પ્રદેશના નીમય પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. આ ઘટનાની જાણ દેસર પોલીસને કોન્સ્ટેબલ મહિલા ચૌધરીના પાર્ટનર સદામ ગરાસિયાએ કરી હતી. ગરાસિયાએ દાવો કર્યો હતો કે, તેણે શુક્રવારે ચૌધરીને ફોન કર્યો હતો, કારણ કે તે લેટ થઈ ગયા હતા. તેઓએ પોલીસને એવું જણાવ્યું કે, નજરે જોનારોએ તેમને એવું જણાવ્યું કે, ચૌધરીનું અપહરણ વેજપુર ગામની પાસે આવેલી એક કેનાલ પાસેથી કરવામાં આવ્યું હતું. તેમનું વાહન પણ નહેર પાસેથી મળી આવ્યું હતું. આ ઘટના બાદ ગરાસિયાએ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી હતી. જો કે, મહિલા ચૌધરી ઘરે ગયા એ પહેલાં શુક્રવારની સવાર સુધી વાયરલેસ સેટ પર ફરજ પર હતા. શનિવારે સામે આવ્યું કે મહિલા ચૌધરી મધ્ય પ્રદેશના નીમય પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. તેઓ કેવી રીતે ત્યાં પહોંચ્યા એ અંગે પોલીસ પાસે કોઈ જાણકારી નથી, એવું દેસર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એ.એમ. પરમારે જણાવ્યું હતું. મહત્વનું છે કે, મહિલા ચૌધરી પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા. જ્યાં તેમનો સંપર્ક ગરાસિયા સાથે થયો હતો અને બંને પ્રેમમાં પડ્યા હતા. ગયા જાન્યુઆરી મહિનામાં પણ આવું જ કંઈ થયું હતું.

ભેંસોએ વળતો પ્રહાર કરી વનરાજને ભગાડ્યો ૧૫ વર્ષના છોકરા પર સિંહે એકાએક જ હુમલો કર્યો

ભેંસોએ છોકરાને બચાવીને વફાદારી બતાવી : જો ભેંસોએ છોકરાને ના બચાવ્યો હોત તો તેનો જીવ પણ જઈ શક્યો હોત

રાજકોટ, તા.૯ |

ભેંસની ગણતરી એવા પશુઓમાં થાય છે જે સિંહ સામે પડીને તેને પણ ઉગ્ર ટક્કર આપી શકે છે. ક્યારેક ભેંસો વનરાજને ડરાવીને ભગાડી મૂકે છે તો ક્યારેક તેમનો શિકાર પણ થઈ જાય છે. ભેંસની ગણતરી ભલે દુનિયાના સૌથી વફાદાર પ્રાણીઓમાં ના થતી હોય પરંતુ તેણે ૧૫ વર્ષીય છોકરાને સિંહના હુમલાથી બચાવીને પોતાની વફાદારી બતાવી છે. જૂનાગઢ જિલ્લાના જંગલ વિસ્તારમાં ૧૫ વર્ષીય માલધારીને ભેંસે સિંહના હુમલાથી ના બચાવ્યો હોત તો કદાચ આજે તે જીવતો ના હોત. કાદવળી નેસમાં રહેતો વિક્રમ ચાવડા પોતાના પાલતુ

પશુઓને પાણી પીવડાવવા લઈને જઈ રહ્યો હતો. ગીરના પશ્ચિમ ભાગમાં આવેલી વિસાવદર ફોરેસ્ટ રેન્જમાં સ્થિત બાગોયા વિસ્તારમાં તે પશુઓને લઈને જઈ રહ્યો હતો. તેની સાથે બે કિશોર વયના બાળકો સહિત અન્ય માલધારીઓ પણ હતા. વિક્રમ પોતાના બાપા પર નવજાત વાહરડાને બેસાડીને લઈ જઈ રહ્યો હતો. માલધારીઓને સહેજ પણ અંદાજો નહોતો કે તેઓ જ્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યાંથી સિંહ અને સિંહણનું મેટિંગ ચાલી રહ્યું છે. સિંહે એકાએક વિક્રમ પર હુમલો કર્યો હતો. એકાએક હુમલાથી વિક્રમ ગભરાઈ ગયો હતો પરંતુ ધણમાંથી બે ભેંસો દોડી આવી

અને સિંહની સામે પડી. આ જોઈને બીજા માલધારીઓ સતર્ક થઈ ગયા અને વળતો હુમલો થતાં સિંહ પણ જંગલમાં નાસી ગયો. ગીર વેસ્ટ ડિવિઝનના નાયબ વન સંરક્ષક પ્રણાત તોમરે કહ્યું, "જો ભેંસો ના હોત તો વિક્રમને ગંભીર ઈજાઓ થઈ હોત." વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિક્રમને પીઠ અને નિતંબના ભાગમાં આઠ ટાંકા લેવામાં આવ્યા છે. પહેલા તો તેને પ્રાથમિક સારવાર માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો.

પત્નીને પોલીસમાં નોકરી મળ્યા બાદ વર્તન બદલાયું પત્નીને ભણાવવા માટે પતિએ પોતાની જમીન પણ વેંચી દીધી

પ્રયાગરાજ, તા.૯ |

પ્રયાગરાજમાં સફાઈકર્મી આલોક મોર્ય અને તેની પત્ની એસીએમ જ્યોતિ મોર્ય વચ્ચેના વિવાદનો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો પ્રયાગરાજથી ૫૦ કિમી દૂર આવેલા મેજાના જરા ગામનો છે. અહીં રહેતા રવિન્દ્ર કુમાર પ્રાઈવેટ કામ કરે છે. તેમની પત્ની રેશમા યુપી પોલીસમાં કોન્સ્ટેબલ છે. રવિન્દ્ર કુમારનું કહેવું છે કે, જમીન વેચીને તેમણે તેમની પત્નીને ભણાવી હતી. જ્યારે રેશમા યુપી સરકારમાં પોલીસ ખાતામાં જોઈને થઈ તો અમારાથી છોડો ફાડવા લાગી હતી. પત્નીના આ વ્યવહારથી રવિન્દ્ર કુમાર હેરાન થઈ ગયા હતા. તેમા લગ્ન ૨૦૧૭માં થયા હતા. લગ્નના એક વર્ષ સુધી પત્ની અને પતિ વચ્ચે બધું જ બરાબર હતું. રવિન્દ્ર કુમાર પ્રાઈવેટમાં નોકરી કરે છે અને તેમની પત્ની ઘરે રહીને સરકારી નોકરીની તૈયારીઓ કરતી હતી. બંનેના સંબંધોમાં તિરાડ ત્યારે પડી કે જ્યારે એક વર્ષ બાદ રેશમાનું સિલેક્શન યુપી પોલીસમાં થઈ ગયું. રવિન્દ્રના જણાવ્યા મુજબ, પોલીસમાં સિલેક્શન થઈ ગયું હતું. મેં રેશમાના અભ્યાસ માટે



ભણાવવા માટે પ્રેમ ભારે પડ્યો

જરૂરી તમામ વ્યવસ્થા કરી આપી હતી. એટલું જ નહીં મારી જમીન પણ વેચી દીધી હતી. પછી પત્નીને ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરાવ્યો. અમે ખૂબ જ મહેનત કરી અને તેના માટે ફી ભરી હતી. જ્યારે રેશમાનું સિલેક્શન થયું એ પછી તેના સ્વભાવ અને વર્તનમાં ફેરફાર જોવા મળ્યો હતો. પત્નીનું પોલીસ ખાતામાં સિલેક્શન થઈ ગયા બાદ પણ હું તેની સતત સેનવા કરતો હતો. રવિન્દ્ર પર તેમની પત્નીએ અનેક આરોપો લગાવ્યા છે. આરોપોને રવિન્દ્રએ નકાર્યા હતા અને ન્યાયની માગણી કરી હતી. તેઓએ કહ્યું કે, જો મારી પત્ની પરત આવી જાય તો હું બધું જ ભૂલીને તેને મારી પાસે રાખીશ. રવિન્દ્રની માતા રજવંતી દેવી આ વાત કરતા કરતા રડી પડ્યા હતા. તેઓએ જણાવ્યું કે, મેં તેને વહુ તરીકે નહીં પણ મારી દીકરી હોય એ રીતે રાખી હતી.

ભુજનું હૃદયસમાન હમીરસર તળાવ ઓવરફ્લો થઈ ગયું

કચ્છ, તા.૯ |

દર વર્ષે ભુજવાસીઓ ચોમાસાની સીઝનમાં જે બાબતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે ઘડી આ વર્ષે ખૂબ ઝડપી આવી ગઈ છે. ભુજનું હૃદયસમાન હમીરસર તળાવ આજે બપોરે ઓવરફ્લો થયું છે. સતત બીજા વર્ષે તળાવ છલકાતા ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ભુજમાં છેલ્લાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે કચ્છમાં વાવાઝોડા બાદ સચરાચર વરસાદ નોંધાયો છે. ત્યારે આજે ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. ભુજ નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ઓંગન સ્થળે વરુણ દેવને નમન કર્યા હતા અને કચ્છની કુળદેવી આશાપુરાનો આભાર માન્યો હતો. ભુજવાસીઓના હૃદય સમાન હમીરસર તળાવ ઓંગનાતા સમગ્ર ભુજમાં આનંદની લાગણી ફેલાઈ છે, તો દેશ વિદેશમાં વસતા કચ્છી લોકોમાં પણ આનંદ ફેલાયો છે. હમીરસર તળાવમાં ઓંગન સ્થળ પર ભુજ નગરપાલિકાના તમામ નગરસેવક પ હાજર રહ્યા હતા અને આ ઐતિહાસિક જાણને વધાવી લીધી હતી.

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવું મર્ડર મોસ્ટ વોન્ટેડે પોતાને મૃત સાબિત કરવા રચ્યું કાવતરું પોતાની હમશકલ જેવા શખસને શોધી કરી દોસ્તી : હત્યા કરી નાખી અને પછી લાશના ટુકડાં કરી નાખ્યા હતા

પંજાબ, તા.૯ |

પંજાબના લુધિયાણામાંથી એક દિલ હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. અહીં એક શખસે પોતાને મરેલો સાબિત કરવા માટે એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી. એ પછી તેના બિસ્સામાં પોતાનું આઈડી નામી દીધું હતું. તેણે શરીરના ટુકડા ટુકડાં કર્યા અને અલગ અલગ ફેંકી દીધા. આ કામમાં આરોપીને તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો. બંને સ્કૂટી પર લાશના ટુકડાં નાખીને ઠેકાણે પાડવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા અને પોતાના કર્મનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારે આ કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. લુધિયાણાના આદર્શનગરમાં માથુ કાપી નાખેલી હાલતમાં એક લાશ મળી હતી. બનાવની જાણ થતા લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. જો કે, માથુ કાપેલી હાલતમાં લાશ મળી આવી હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બાદમાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને પોતાની તપાસ હાથ ધરી હતી. આખરે પોલીસે આરોપી પતિ-પત્નીને ઝડપી પાડ્યા હતા. આરોપીનું

નામ પંકજ છે અને તે અનેક રાજ્યોમાં મોસ્ટ વોન્ટેડ છે. પોતાની ઓળખ ખતમ કરવા માટે આરોપીએ એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પોતાનું ઓળખપત્ર તેના બિસ્સામાં નાખી દીધું હતું. કમિશનર મંદીપ સિદ્ધુએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આરોપી પંકજ આ વ્યક્તિની હત્યા કર્યા બાદ તેનું ગળુ અને હાથની એંગળીઓ કાપી નાખી હતી. બાદમાં તેને એક બોરામાં ભરી દીધી હતી. માથાનો ભાગ અલગ બોરીમાં મૂકી દીધો હતો. એ પછી એકિટવા પર બોરી લઈને તેની પત્ની બેસી ગઈ હતી. બાદમાં બંનેએ લાશને ઠેકાણે પાડી હતી. પોલીસે જ્યારે આ કેસની તપાસ કરી તો પતિ અને પત્ની સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. બાદમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. આરોપી પંકજ આમ તો બિહારનો રહેવાસી છે. તે હાલ તો લુધિયાણાના આદર્શનગરમાં રહે છે. અહીં તેણે પોતાના હમશકલની તપાસ કરી હતી. જેનું નામ રામ પ્રસાદ હતું. તેણે રામ પ્રસાદ સાથે પહેલાં દોસ્તી કરી હતી અને પછી તેને દારુ પીવા બોલાવ્યો હતો. દારુ પીવાબાદ બાદ રામ પ્રસાદનું મોંઢું બંધ કરી નાખ્યું. જેથી તે બ્રુમાબૂમ ન કરે. બાદમાં તેનું ગળુ કાપી નાખ્યું હતું અને લાશના ટુકડાં કર્યાં હતા.

ગરમી અને ગૂંગળામણ થવાથી બાળકીનું થયું મોત કારમાં ૧૮ મહિનાની બાળકીને ભૂલીને જતા રહ્યા માતા-પિતા

આગા, તા.૯ |

તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો હતો કે, કેટલાંક લોકો આગાના તાજમહેલની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પોતાન ડોગીને કારમાં લોકર મારીને તાજમહેલ જોવા જતા રહ્યા હતા. બાદમાં બે કલાક પછી જ્યારે પત્ર આપ્યા ત્યારે ડોગીનું મોત થઈ ચૂક્યું હતું. આવી જ એક ઘટના અમેરિકામાંથી સામે આવી છે. જેના કારણે એક ૧૮ મહિનાના બાળકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બાળકને પેરેન્ટ્સે ચાર જુલાઈના રોજ પાર્ટી કરી હતી. આ ભૂલના કારણે તેઓએ પોતાની દીકરીને કારમાં જ છોડી દીધી હતી. જેના કારણે ગરમી અને ગૂંગળામણ થતા તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ બાળકને સવારના ૩ વાગ્યાથી લઈને ૧૧ વાગ્યા સુધી કારમાં છોડી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન તાપ માન પણ ૧૦૫ ફેરનહિટ હતું. પોલ્ક કાઉન્ટી શેરીફ ગ્રેડી જુડે એક નિવેદનનો હવાલો આપતા કહ્યું કે, માતા-પિતા જોએલ અને જેજિમન રોડે

પોતાના ત્રણ બાળકો સાથે ચાર જુલાઈના રોજ પાર્ટીમાં ભાગ લીધો હતો. બીજા દિવસે સવારે તેઓ લગભગ ૩ વાગ્યા સુધી બહાર રહ્યા હતા. પરત ફર્યા બાદ માતા પોતાના મોટા બાળકને ઘરમાં લઈ ગઈ અને પતિને કહ્યું કે, નાની દીકરીને અંદર લેતા આવે. પીડિત બાળકના પિતા જોએલે કહ્યું કે, જ્યારે તે બાળકને લેવા માટે ગયા ત્યારે કારનો એક દરવાજો ખુલ્લો હતો. તે જમવાની ટ્રે ધરની અંદર લઈ ગયા, જો કે, જ્યારે બહાર આવ્યા તો જોયું કે, કારના તમામ ચારેય દરવાજા બંધ હતા અને લાગ્યું કે, પત્ની બાળકને અંદર લઈ ગઈ હશે. એ પછી તે ઘરમાં જતા રહ્યા હતા. પછી પત્ની અને બાળકો સાથે સુઈ ગયા હતા. તેમણે નાની દીકરી વિશે એકબીજા પાસેથી જાણકારી લીધી નહોતી. જેના કારણે ૧૮ મહિનાની બાળકી ભૂલી જી કારની અંદર રહી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. બાળકના મોત બાદ સ્થાનિક તંત્રએ તેના પેરેન્ટ્સ પર હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પેરેન્ટ્સને પોતાના બાળકના મોતના સમાચાર સવારે ૧૧ વાગ્યે મળ્યા હતા.

તંત્રી લેખ... સારવાર પર વધુ ખર્ચ



વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓ દ્વારા નવો ચોંકાવન-દારો હેવાલ જારી કર્યો છે. જે દર્શાવે છે કે ભારતીય લોકો આવકના તેમના ૧૦ ટકા હિસ્સાને તો સારવાર પર ખર્ચ કરી નાંખે છે. હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ માહિતી આપતા કહ્યું છે કે આવકના ૧૦ ટકા હિસ્સાને ભારતીયો સારવાર પર ખર્ચ કરે છે. હેવાલમાં કહેવામાં આવ્યું છે કે અડધા ભારતીયની જરૂરી આરોગ્ય સેવા સુધી પહોંચ નથી. જ્યારે એવા લોકો જે આરોગ્ય સેવા પર લાભ ઉઠાવી શકે છે તેવા લોકો પૈકી લોકો તેમની સારવાર પર આવકના ૧૦ ટકા હિસ્સાને ખર્ચ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની વેબસાઇટ પર પ્રકાશિત હેવાલમાં કેટલીક નવી વિગત પણ જાહેર કરવામાં આવેલી છે. વર્ષ ૨૦૧૯ના હેવાલ મુજબ ભારતની વસ્તીના ૧૭.૩ ટકા અથવા તો ૨૩ કરોડ નાગરિકોને વર્ષ ૨૦૦૭-૨૦૧૫ દરમિયાન સારવાર પર પોતાની આવકના ૧૦ ટકા કરતા વધારે હિસ્સાને ખર્ચ કરવાની ફરજ પડી હતી. ભારતમાં સારવાર પર પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરનાર પીડિત લોકોની સંખ્યા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની કુલ વસ્તી કરતા પણ વધારે છે. ભારતની તુલનામાં સારવાર પર પોતાની આવકના ૧૦ ટકા હિસ્સાને ખર્ચ કરનાર લોકોની કુલ વસ્તીમાં તેમની ભૂમિકા ઓછી હોય છે. ભારતની તુલનામાં સારવાર પર પોતાની આવકનો ૧૦ ટકાથી વધારે હિસ્સો ખર્ચ કરનાર લોકોની કુલ વસ્તીમાં ૨૮.૮ ટકા, બ્રિટનમાં ૧.૬ ટકા, અમેરિકામાં ૪.૮ ટકા, ચીનમાં ૧૦.૭ ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશની વસ્તીના ૩.૯ ટકા હિસ્સો એટલે કે પાંચ કરોડ ભારતીય પોતાના સ્થાનિક બજેટમાં એક ચતુર્થાંશ કરતા વધારે ખર્ચ સારવાર પર કરે છે. જ્યારે શ્રીલંકામાં આવી વસ્તી ૦.૧ ટકા છે. બ્રિટનમાં આવી વસ્તી ૦.૫ ટકાની છે. અમેરિકામાં આવી વસ્તી ૦.૮ ટકાની છે. ચીનમાં ૪.૮ ટકાની છે. તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં થતા બેકેટરિયલ ઈન્ફેક્શનના કારણે ભારતમાં દર વર્ષે જન્મના પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોના મોત થઈ જાય છે. અભ્યાસમાં ચોંકાવનારા તારણ સપાટી પર આવ્યા બાદ આરોગ્યને લઈને ભારતમાં નવજાત શિશુના મામલે ગંભીર ચિત્ર સપાટી પર આવ્યું છે. સેન્ટર ફોર ડીસીડઝાઇનેમિક્સ ઈકોનોમિક્સ એન્ડ પોલિસી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આશરે ૧૦ લાખ ભારતીય નવજાત શિશુ દર વર્ષે લાઈફના પ્રથમ ચાર સપ્તાહમાં મૃત્યુ પામે છે.



ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્સી 'મોનાલિસા' અને તેનું પેઇન્ટિંગ આજે પણ એક રહસ્ય છે

આ પછે રોજબરોજનાં લેખકનમાં કંઈક જાણવા પ્રયત્ન કરીએ છીએ આજે મોનાલીસા તેનું ચિત્ર અને રહસ્ય વિશે જાણીએ. તમારામાંથી ઘણાએ મહાન ઈટાલિયન ફિલસૂફ અને ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્સી વિશે સાંભળ્યું જ હશે. યુરોપીયન પુનરુદ્ધીવાનમાં ઘણા મહાન ફિલસૂફો હતા, જેમાંથી તે એક હતો. તેમના દ્વારા બનાવેલ 'મોનાલિસા' પેઇન્ટિંગ આજે પણ એક રહસ્ય છે. છેવટે, આ પેઇન્ટિંગમાં એવું શું છે, જેના વિશે ઘણા નિષ્ણાતો તેમાં ઘણું સંશોધન કરી રહ્યા છે? આ સંબંધમાં આજે આપણે એનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરીશું તમને જણાવી દઈએ કે આજે આ પેઇન્ટિંગની કિંમત લગભગ ૮૬૭ મિલિયન ડોલર છે, જેની ભારતમાં કિંમત ૬.૪ હજાર કરોડ રૂપિયા છે. લિયોનાર્ડો દા વિન્સીએ વર્ષ ૧૫૦૩માં આ પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી. ૧૫૧૭નું વર્ષ નજીક આવતાં પણ તેણે આ પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ રાખ્યું. મોનાલિસાના હોઠ બનાવવામાં સૌથી વધુ મુશ્કેલી લિયોનાર્ડોને પડી હતી. માત્ર મોનાલિસાના હોઠ બનાવવા માટે તેણે લગભગ બારનો સમય લીધો હતો. મોનાલિસાની પેઇન્ટિંગનું સૌથી મોટું રહસ્ય તેની સ્મિત છે. લાંબા સમયથી ઘણા નિષ્ણાતો તેના રહસ્યમય સ્મિતનો અભ્યાસ કરી રહ્યા છે. મોનાલિસાનું આ રહસ્યમય સ્મિત અલગ-અલગ અંગલથી જોવામાં આવે તો અલગ જ લાગે છે. જો તમે તેને એક બાજુથી જોઈ રહ્યા છો, તો આ સ્મિત હાસ્ય જેવું લાગશે. તેને બીજા ખૂણાથી જોતી વખતે, તેનું સ્મિત દૂર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે જે મહિલાની લિયોનાર્ડોએ આ પેઇન્ટિંગ બનાવી હતી. તે પોતાની અંદર એક રહસ્ય છુપાવે છે. આ કારણથી મોનાલિસાની સ્માઈલ એકદમ રહસ્યમય છે. થોડા વર્ષો પહેલા એક ડોક્ટરે આ રહસ્ય ખોલ્યું હતું અને કહ્યું હતું કે મોનાલિસાના ઉપરના બે દાંત તૂટી ગયા છે. તેના કારણે તેના ઉપરના હોઠ સહેજ અંદરની તરફ દબાયેલા છે. વર્ષ ૨૦૦૦માં હાર્વર્ડના ન્યુરોસાયન્ટિસ્ટે મોનાલિસાના આ પેઇન્ટિંગ પર સંશોધન કર્યા બાદ કહ્યું હતું કે મોનાલિસાનું સ્મિત ક્યારેય બદલાતું નથી, પરંતુ તમારી માનસિકતા એવી જ રહે છે. એ જ રીતે તમે મોનાલિસાની પેઇન્ટિંગ જુઓ. જો તમે મુશ્કેલી છે, તો તમે મોનાલિસાને હસતી જોશો. બીજી તરફ, જો તમે ઉદાસ હોવ તો મોનાલિસાનું આ સ્મિત ફિક્કું પડી જશે. જો કે આજે પણ એ જાણી શકાયું નથી કે મોનાલિસા કોણ હતી? એટલે કે, જે છોકરીનું ચિત્ર લિયોનાર્ડોએ બનાવ્યું હતું, તે છોકરી પણ આ પેઇન્ટિંગ જેવું રહસ્ય છે. તે જ સમયે, એક સિદ્ધાંત કહે છે કે મોનાલિસા બીજું કોઈ નહીં પરંતુ લિયોનાર્ડો પોતે જ હતી. આ પેઇન્ટિંગમાં લિયોનાર્ડોએ પોતાને એક મહિલા તરીકે બનાવ્યો હતો. આ અત્યાર સુધીની સૌથી મોંઘી પેઇન્ટિંગ છે, જેની કિંમત લગભગ ૮૬૭ મિલિયન છે. ભારતમાં તેની કિંમત લગભગ ૬.૪ હજાર કરોડ રૂપિયા છે.

વાચક ચાહક મિત્રો આપણે વરસાદી અને બકારાના માહોલનો આજે એક અનોખી વાત કરી છે.

આપણાં ભાવ વિશ્વમાં અવાસ્તવિક અને વાસ્તવિક દુનિયાનો સમન્વય કરાવીને એક શુદ્ધ ભાવની સ્થાપના શકે એવું કોઈ તત્વ હોય તો એ શિવલિંગ છે



સદગુરુ વયનામૂર્ત સંકલન : ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

હે ઈશ્વર. આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ભારતીય સનાતન સંસ્કૃતિમાં ઈશ્વરના બહુધા સ્વરૂપો જોવા મળે છે, તેમજ પ્રાંત પ્રમાણે ત્યાંનાં સ્થાનક કે તીર્થ અનુસાર પણ જુદા જુદા સ્વરૂપનું મહત્વ દર્શાવાયું છે. તેમજ હિન્દુ પંચાંગ મુજબ વર્તમાન સમય અનુસાર પણ જુદા જુદા જાંમકે નવરાત્રી હોય તો સૌ માંદશક્તિની આરાધના કરે, શ્રાદ્ધ હોય તો પિતૃની વંદના કરે, શ્રાવણ હોય તો શિવ શંકરની આરાધના, અને ભાદરવો આવે એટલે સૌને ગણપતિ દાદા યાદ આવે, એટલે એવું નથી કે બાકીના સમયમાં એને યાદ કરતાં ન હોય, પણ આ દિવસોમાં વિશેષ મહત્વ હોય. દરેક વ્યક્તિનું ઈશ્વરનાં તે સ્વરૂપને પસંદ કરવાનું કારણ પણ જુદુ જુદુ હોય છે, તેમજ તેની આરાધનાની એટલે કે ઈશ્વર અનુસંધાન કરવાની રીતો પણ અલગ અલગ હોય છે. પરંતુ મુખ્યત્વે ભાવ ભક્તિનો બની રહે, તો ફળ શ્રુતિ રૂપે કંઈક પ્રાપ્ત થાય. સનાતન ધર્મ સાથે સદીઓથી પ્રભુ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે, અને એટલે જ લોકોનો આદર્શ રામ જેવો હોવો જોઈએ! પ્રેમ કૃપ્ણ જેવો હોવો જોઈએ! અને કરુણા ભગવાન શંકર જેવી. ભારતીય સનાતન ધાર્મમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ રીતે ત્રિદેવની સંકલ્પના પણ જોવામાં આવે છે, અને એ રીતે ભગવાન શિવને સંહારકર્તા તરીકે આપણે સૌ ઓળખીએ છીએ, અને ભારતમાં મોટેભાગે ભગવાન શિવ મૂર્તિ રૂપે નહીં, પરંતુ શિવલિંગ રૂપે પૂજાય છે. સીધું સાદું સ્મરણ, ન કોઈ લાંબી સાધના પદ્ધતિ, કે ન કોઈ વિશેષ ભોગ! બસ દૂધ કે પાણીનો અભિષેક કરી અને સીધા સાદા મંત્ર ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરવાથી ભગવાન શિવ પ્રસંગમાં રહે છે.



રાખજે, અને એ પણ સંસારી રસથી ભરેલો. સર્જન હોય તેનું વિસર્જન પણ જરૂરી છે, એ પ્રકૃતિનો એક નિયમ છે, અને પ્રકૃતિ એ જ રીતે પરિવર્તન કરતી હોય છે. આ બધું જ જાણવા છતાં આપણને આપણા મૃત્યુનો ડર રહે છે, અને ભગવાન શંકરની આપણી પર કૃપા બની રહે માટે આપણે તેને આરાધતા રહીએ છીએ, અને ભોગો દેવનો દેવ એટલે કે મહાદેવ આમ જ કૃપા કરે છે. હમણાં હાલમાં જ એક વિડીયો જોવો હતો કે શિવલિંગને આપણા બોડીનાં કયા પાર્ટ સાથે સરખાવ્યું છે, અથવા એ આકાર આપણાં બોડીમા કયા છે? મસ્તિષ્ક અને ધડને જોડતી ગરદનમાં એ આકારનો એક દંડ છે, જે શિવલિંગ છે, એવું એમાં કહ્યું. આજકાલ લોકો પ્રસિધ્ધિ મેળવવા માટે આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે, એટલે એ વીડીયોમાં કેટલું સત્ય છે, એ જાણતા નથી. પરંતુ થોડું તથ્ય છે, અને એને આપણે જુદી રીતે મૂલવીને આજે સોમવાર એટલે ચરિત્રની સાચી ઓળખમાં શિવ લિંગની વાત કરીશું.

આપણા શરીરની વાત કરીએ તો મસ્તિષ્કમાં મગજ આવેલું છે અને નીચેના ધડના શરીરમાં ધબકતું હૃદય આવેલું છે. એટલે સીધા સાદા શબ્દોમાં કહીએ તો આ શિવલિંગનો દંડ એ હૃદય કે મન અને મગજને જોડનાર એક અવિભાજ્ય અંગ છે. મનને સ્વયં ભગવાન યોગ યોગેશ્વર એ પોતાની વિભૂતિ ગણાવી છે અને મન હોય તો જ આપણે લાગણીનો અનુભવ કરી શકીએ. પણ મન દ્વારા જે ઈચ્છાની માંગ થાય એ પૂરી કરવા મગજ સતત ક્રિયા માટે આખાં શરીરની ઈન્દ્રિયોને આદેશ આપે. આકારની રીતે તો દરેકમાં આ આકાર હોય પણ, એને શિવલિંગ બનાવવું પડે, અથવા તો મન અને મગજની ક્રિયા અન્યના લાભાર્થે કે કલ્યાણે હોય એ મુજબ એને કાર્યરત રાખવું પડે. સામાન્ય માણસના મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે મગજ પોતાની બુદ્ધિશક્તિને જુદી જુદી રીતે પ્રયોજી અને કાર્ય કરે છે. પરંતુ જેનું મન પવિત્ર છે, એ પોતાના મસ્તિષ્ક ને અન્યના કલ્યાણ માટે કાર્યરત રાખે, અને તો આ દંડ શિવલિંગ કહેવાય.

કદાચ એટલે જ ભારતભરમાં કેટલાય શિવલિંગ અને શિવાલયો રહેશે. પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ શિવાલયો રહેશે અને એ શિવાલયોમાં જનારા ભક્તો પણ રહેશે. આમ તો ગુરુપૂર્ણિમા ગઈ એટલે અત્યારે અષાઢવદ યાત્રી રહ્યા છે અને ૧૦, ૧૨ દિવસમાં જ શ્રાવણ આવે. પરંતુ આ વખતે અધિક માસ હોવાથી, શ્રાવણને હજી વાર છે. આ સમય ગાળા દરમિયાન આપણે શિવલિંગની આ રીતે પરિકલ્પના કરી શકીએ, અથવા તો શિવલિંગની બદલે એને આત્મલિંગ નામ આપીને અવાસ્તવિક અને વાસ્તવિક દુનિયાનો સમન્વય કરતું અંગ બનાવી શંકરના મુખ્ય ગુણ એટલે કે ' કલ્યાણ એ જ શંકર' એ મુજબ આપણા મન અને મગજને કાર્યરત રાખવાં, શ્રાવણ સુધીમાં તૈયાર કરી દઈએ, તો આ શ્રાવણીય આરાધનાનાં અભિષેકમાં સમગ્ર વિશ્વના શુભ મંગલ કે કલ્યાણનું આપણા દ્વારા કંઈક વિશિષ્ટ કર્મ થઈ શકે ખરું! વસ્તુ પદાર્થ તરીકે આપણે દૂધ, પાણી, બિલિપત્ર, તલ, જે કોઈ દ્રવ્યથી અભિષેક કરતા હોઈએ એ તો સંસાત્મક રીતે કરીએ પરંતુ મૂળ કલ્યાણની ભાવના રહે તો એ અતિ ઉત્તમ અભિષેક છે, એ યાદ રાખવું ઘટે. હંમેશા દેશકાળ પ્રમાણે ઈશ્વર અનુસંધાન થવું જોઈએ! તો જ એ જડપથી પરિણામ આપે, એવું શાસ્ત્રોમાં લખાયું છે. હમણાં પણ એક વાર ચિંતનમાં ઉલ્લેખ થયો હતો કે, મહિનો માસ સુધી ભૂખ્યા રહેવું, એકટાણા કરવાં, એ બધું આ ઋતુ અનુસાર શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી હતું, માટે એવી પ્રણાલી નક્કી થઈ. પરંતુ આજકાલ લોકો એકટાણાના નામે એટલા બધા વ્યજનો આરોગ્ય છે કે, જે શરીરને સ્વસ્થ રાખવા કરતા ઉલટા નું દુરસ્ત કરે છે. તો આ શ્રાવણે આપણે આપણા ઉપરાંત એકને પેટપૂજા કરાવીશું એવું કોઈ વ્રત લઈએ, જે વધારે ને જમાડી શકે, એ મુશ્કેલ છે. એટલે કે યથાવશક્તિ યથા સમજ આ રીતે આ શ્રાવણે ભગવાનને ભજીશું તો, એ આપણે શિવ શંકર સુધી વધુ જડપથી લઈ જશે. અથવા તો આપણામાં રહેલું આ લિંગ શિવલિંગ રૂપે કાર્ય કરતું થશે. આપણા શરીરમાં મન અને મગજ ને જોડતો આ દંડ શિવલિંગ રૂપે પ્રતિષ્ઠિત થાય અને પછી આપણે સૌનાં કલ્યાણ માટે જીવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું, ફરી મળીશું તમા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

વ્યક્તિના સ્વભાવ અને વિચાર માટે મોટા ભાગે હાર્મોન્સ જવાબદાર હોય છે : કેટલાક લોકોને નાની નાની વાતે ગુસ્સો આવે છે નાની નાની વાતોમાં મુડ કેમ ખરાબ ?

હાલના સમયમાં લોકોમાં હાર્મોન્સનું પ્રમાણ વધી રહ્યું છે. નાની નાની બાબતોમાં ગુસ્સો લોકો કરી રહ્યા છે. પેશેન્સ અથવા તો ધીરજ અને સંયમની બાબતો લોકોમાં દેખાતી નથી. આવી સ્થિતિમાં ખુબ મોટી જટિલ સમસ્યા સર્જાઈ ગઈ છે. સામાન્ય રીતે નાની નાની બાબતોમાં લોકોમાં ગુસ્સો કેમ આવી રહ્યો છે તેને લઈને અભ્યાસની કામગીરી પણ હાલમાં હાથ ધરવામાં આવી છે. અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ કહી શકાય છે કે સોશિયલ મિડિયા અને મોબાઈલ એપને કારણે લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે. ગુસ્સાનું પ્રમાણ લોકોમાં વધવા માટે કેટલાક કારણો રહેલા છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે સોશિયલ મિડિયા પર વર્ચુઅલ વાતચીતના કારણે સંબંધોની સંવેદનશીલતા ઘટી રહી છે. ટીવી અને મોબાઈલ પર હિંસાવાળા વિડિયો નિહાળવા, કોઈ પણ હેતુ વગર મોબાઈલ સ્ક્રીનિંગ જેવી બાબતો ગુસ્સાના કારણ તરીકે છે. કમાણી કરતા વધારે ખર્ચ, ક્ષમતા કરતા વધારે પ્રમાણમાં લોન લઈ લેવી અને ત્યારબાદ નહીં ચુકવવા જેવી બાબતો પણ આમાં સામેલ રહી છે. મોડી રાતે ઉંઘી જવાની બાબત અને વહેલી સવારે ઉઠી જવા જેવી બાબત પણ ગુસ્સાને વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે. કેરિયરમાં પ્રગતિને લઈને અસંતોષ, કાર્યબોજ વર્ચુઅલ વર્લ્ડમાં તમામ ચીજો બસ એક ક્લીકમાં સરળરીતે ઉપલબ્ધ બની જાય છે. આના માટે રાહ જોવાની જરૂર રહેતી નથી. એક ક્લીકમાં પેમેન્ટ પણ થઈ જાય છે. ઈચ્છિત ચીજો પણ તરત જ મળી જાય છે. તમામ સુવિધા મળી જાય છે. આના કારણે લોકોના વ્યવહારમાં હવે ઈન્ટરનેટ પાતમ થવાની દિશામાં છે. સોશિયલ મિડિયાના વધારે પડતા ઉપયોગના કારણે આમને સામને હવે વાતચીત ઓછી થઈ રહી છે. લોકો નાની નાની વાત પર હાઈપર થઈ જાય છે. તેજ અવાજમાં વાત કરે છે. અથવા તો ડિપ્રેશનમાં રહે છે. તેમનામાં કાર્ટિસોલ, સેરોટોનિન હાર્મોનનું



લેવેલ ઘટી જાય છે. ઈન્સુલિન હાર્મોન સ્થિતિમાં પણ કેટલાક લોકો તો હોર્મોન વગાડી વગાડીને નારાજગી વ્યક્ત કરે છે. થોડાંક બિલ્ડ થવાની સ્થિતિમાં જાહેરમાં દલીલબાજી પણ કેટલાક લોકો કરે છે. કેટલાક લોકો તો તરત જ મારામારી પર ઉતરી આવે છે. ઘરમાં પણ નાની નાની બાબતોમાં લડવાની શરૂઆત થઈ જાય છે. આના કારણે પોતાના લોકોની સાથે જ દુરી થઈ જાય છે. હવે ઈન્ટરનેટના કારણે ગુસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે. ગુસ્સા માટે કેટલાક અન્ય કારણો પણ રહેલા છે. જેમાં ભોજનની બાબત પણ સામેલ છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સમયસર લેવામાં આવે તે જરૂરી છે. સિઝનલ ફુટ, શાકભાજી અને એન્ટીઓક્સીડન્ટ યુક્ત ચીજો ખાવાની પદ્ધતિ સલાહ આપવામાં આવે છે. લાંબા સમય સુધી ભૂખ રાખવી જોઈએ નહીં. વિટામિન બી, બીબીબી જેવી ચીજો લેવી જોઈએ. આધુનિક સમયમાં અમે જોઈ રહ્યા છીએ કે નાની નાની બાબતોમાં લોકોના મુડ ખરાબ થઈ જાય છે. કેટલાક લોકો તો ફોન ન લાગવાની સ્થિતિમાં મોબાઈલ પણ પછાડી દેતા

દનબોક્સ હમેંશા વ્યવસ્થિત રહે છે ?

મોટા ભાગના લોકો જીવે, આઉટલુક અથવા તો યાહુ જેવા સર્વિસ પ્રોવાઈડર્સની સાથે મલ્ટીપલ ઈમેલ એકાઉન્ટ સ રાખે છે. તેમને સંબંધિત વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્સની મદદથી ઓનલાઈન ઉપયોગ કરી શકાય છે. મલ્ટીપલ એકાઉન્ટને મેનેજ કરવાની એક સમસ્યા હોઈ શકે છે. આવી સ્થિતિમાં એક ઈમેલ ક્લાઉડ ઉપયોગી સોલ્યુશન બની શકે છે. જે એક સ્થાન પર આપના તમામ મેસેજ સિક્ક કરી નાંખે છે. ઈમેલ ક્લાઉડ વધારાના ફિચર જેમ કે વધારાની સુરક્ષા મેસેજ બ્રેક અપ જેવી પણ ઓફર કરે છે. કેટલાક શાનદાર ઈમેલ ક્લાઉડ્સ રહેલા છે. જે અંગે લોકો પાસે હાલમાં એટલી માહિતી રહેલી નથી. આ ઈમેલ ક્લાઉડ કોર્પોરેશન ૫૦૦ કંપનીઓ જેમ કે અવિસ, મેકડોનાલ્ડ અને ટોયાટા દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અનેક ફિચર રહેલા છે. જેમ કે કેલેન્ડર, કોન્ટેક્ટ્સ અને ચેટનો સમાવેશ થાય છે. આ તમામ મોટી ઈમેલ સર્વિસ જેમ કે જીમેલ, યાહુ, આઉટલુક અને આઉટલુક ડોમ કોમ માટે સપોર્ટ કરે છે. તેના લેટેસ્ટ વર્જન પીજીપી ઈન્કીપ્શન, લાઈવ બેકઅપ અને જીમેલ માટે ઓટો રિપ્લાઈ ઓફર કરે છે. આ ફી ટિયર છે. પરંતુ કોમર્શિયલ ઉપયોગ માટે પ્રો વર્જન જરૂરી છે. ઈમ ક્લાઉડ શાનદાર ઈમેલ ક્લાઉડ તરીકે રહે છે. આવી જ રીતે મેલબંડ પ્રો ઈમેલ ક્લાઉડ મલ્ટીપલ એકાઉન્ટને મેનેજ કરવામાં સમય બચાવી લે છે. તે ઈમેલને સુન્દર બનાવે છે. તે ઈમેલને વધારે શાનદાર અને યોગ્ય બનાવે છે. ઈમેલને વધારે કસ્ટમાઈઝ કરવા માટે અનેક ફી થીમ્સની ઓફર કરે છે. તે અનેક પ્રકારના ઈન્ડિવિડ્યુઅલ એપ્સ જેમ કે વ્હાટ્સ ઓપ, ગુગલ ડોક્સ, ગુગલ કેલેન્ડર, ફેસબુક, ટ્વિટર, ડ્રોપ બોક્સ અને સ્લેકને સપોર્ટ કરે છે. તેની મદદથી સામાન્ય લોકો તેમના ઈનબોક્સને શાનદાર બનાવી શકે છે. જાણકાર લોકો અને બજાર સાથે જોડાયેલા કારોબારી લોકો કહે છે કે માર્કેટકોર્સટના આઉટલુકને મોટા ભાગે બિઝનેસ અને એન્ટરપ્રાઇઝ માટે વધારે ઉપયોગી ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં તેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. આ અન્ય માર્કેટકોર્સટ સર્વિસેઝની સાથે ઈન્ડિવિડ્યુઅલ છે. આ ઈમેલ સર્વિસને મેસેજના સિમ્પલ એક્સચેન્જની સાથે ખુબ દુર લઈને જાય છે. આઉટલુકની સાથે વધારો ફાયદો એ છે કે તે આઉટલુક કેલેન્ડરની સાથે પૂર્ણ રીતે ઈન્ડિવિડ્યુઅલ છે. આના કારણે મિટિંગ્સના કોર્ડિનેશન માટે કેલેન્ડર શેયર કરી શકાય છે. તે ઈન્ડિવિડ્યુઅલ આઉટલુક કોન્ટેક્ટ્સ સુધી રહે છે. તે માર્કેટકોર્સટ ઓફિસ સ્યુટની જેમ તેના એક હિસ્સા તરીકે છે. આને સ્ટેન્ડ-એલોન ઓફિસ ૨૦૧૬ અથવા તો સ્પેસકેથિન આધારિત ઓફિસ ૩૬૫ તરીકે ખરીદી શકાય છે. આવી જ રીતે ઈન્કીમાં પણ અનેક પ્રકારની સુવિધા રહેલી છે. આ ઈમેલ ક્લાઉડ સિક્સોરિટી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. તે એઆઈ, મશીન લર્નિંગ અને કોમ્પ્યુટર વિજન એલ્યોરિડેશનનો ઉપયોગ કરીને દરેક પ્રકારના ફિજિંગ એટેકને રોકે છે. તે ક્લાઉડ ઈન્ટરનલ અને એક્સટરનલ બંને ઈમેલને સ્કેન કરે છે. સાથે સાથે ફિજિંગના પ્રયાસોના સંબંધમાં માહિતી એકત્રિત કરે છે. ઈમેલ સર્વિસને સુરક્ષિત રાખવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. આધુનિક સમયમાં કેટલાક ઈમેલ ક્લાઉડ ખુબ ફાયદાકારક અને સમય બચાવવા માટેનું કામ કરે છે. મેલ ઓફ વિન્ડો ૧૦ની વાત કરવામાં આવે તો પણ તેના અનેક ફાયદા રહેલા છે.

ઝાલોદની ગોંગદિયા વર્ગ ડુંગરી પ્રા. શાળામાં વિદાય સમારંભ યોજાયો



। પંકજ પંડિત ઝાલોદ, તા.૯ ।
આજરોજ બપોરે ૧૨:૩૦ કલાકે બદલી પામેલ ૪ શિક્ષક મિત્રો ને સન્માન સાથે સ્ટાફ મિત્રો એ SMC કમિટીના અધ્યક્ષ, શિક્ષણ વિદે તથા વાલીગણ ની હાજરીમાં સાલ ઓઢાડી ભેટરૂપે યાદગીરી માટે ઘડીયાળ આપી બહુમાન કરવામાં આવ્યું. હળવો નાસ્તો કરી મીઠી યાદો સાથે વિદાય લેનાર મિત્રો એ ૪ નંગ પંખા ભેટરૂપે શાળા ને આપવાની જાહેરાત કરી, વિદાય લેનાર શિક્ષક મિત્રો માંથી બારીઆ ગોવિંદસિંહ સખુરભાઈ તરફ થી શાળા ને સરસ્વતી માં નો ફોટો ભેટ આપવા માં આવ્યો. પોતાના વર્ગ

શિક્ષક હવે પાછા કાયમ માટે ભણાવવા આવશે નહીં તેની જાણ થતાં શાળા માં બાળકો અમારા સાહેબ જતા રહ્યા એવી વાતો કરી વારંવાર આંખો માંથી ચોધાર આંસુઓ પાડી રડવા લાગ્યા. તેમને ફરી મળવા આવવાનું વચન આપ્યું, વિદાય લેનાર શિક્ષક મિત્રો સાથે શાળા માં તમામ બાળકો અને શિક્ષક મિત્રો આંસુ રોકી શક્યા નહોતા, શાળા પરિસરમાં દુઃખ ની સાથે ગમગીની છવાઈ ગઈ હતી. ભારે હૃદયે બધા એક બીજા ને ભેટીને છુટા પડ્યા. વિદાય લેનાર શિક્ષક મિત્રો એ યાદગીરી માટે આસોંપાલવ ના છોડનું વાવેતર કરી બાળકોને જાળવણી કરવા સુચન કર્યું.

મામલતદાર સરપંચ અને તલાટી ટીમ ઘટના સ્થળે પહોંચતા આગેવાનો યુનું મેં કરવા લાગ્યા સંજેલી ક્ષણી ફળિયામાં ચોમાસાના પાણીના નિકાલ માટે બીજુ વાર મામલતદારને આવેદનપત્ર આપ્યું



। ઝાલોદ, તા.૯ ।
સંજેલી ક્ષણી ફળિયામાં રસ્તાની કામગીરી દરમિયાન વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિક લોકોના ઘર આંગણે જ વરસાદી પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળવાની ભીતી પાણીનો યોગ્ય નિકાલ માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું. સંજેલી નગરમાં ગોકુળગતીએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી અને રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે ગામના જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની ગુણવત્તાની તપાસ કરવામાં આવતી નથી હજુ તો રસ્તાની કામગીરી પૂર્ણ થઈ નથી અને પ્રથમ વરસાદે પૂર્વ સરપંચ ના ઘર આંગણેજ તંત્રની પોલ ખોલી નાખી છે ક્ષણી ફળિયા વિસ્તારમાં રસ્તાની કામગીરી શરૂ થતા જ ભાવનગરી હોટલ તેમજ મંદિર પાસેની રસ્તાની બંને સાઈટ બંધ કરી દેતા આ વિસ્તારના લોકો ના ઘર આંગણે જ વરસાદી પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે ફળિયાના

જાગૃત નાગરિકો દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરતા મામલતદાર અને તાલુકા પંચાયત તેમજ સરપંચ અને તલાટી ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં અરજદારો તેમજ સ્થાનિક આગેવાનો આમને સામને યુનું મેં મેના દ્રશ્યે સર્જણ હતા વરસાદી પાણીના નિકાલ માટે તો તેયાર જ છે પરંતુ ગટરના પાણી પસાર નહીં થવા દઈએ જ્યાં સુધી ગટરના પાણી બંધ નહીં થાય ત્યાં સુધી રસ્તા ની સાઈટો ખોલવામાં નહીં આવે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરતા તંત્ર દ્વારા કોઈપણ જાતનો નિર્ણય લીધા વિના જ જગ્યા છોડી અને રવાના થઈ ગયા હતા. સંજેલી પંચાયત તંત્ર જાણે ખાડે ગયું હોય તેમ ગટરના પાણી રોડ પર વહેવા લાગ્યા છે અને જેને લઈને પ્રાથમિક શાળાના ભૂલકાઓને આ ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે ગટરોની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તેમ છતાં ગટરો બનાવવામાં આવતી નથી હાલ પણ આ વિસ્તારમાં ગટર બનાવવામાં આવે તો તમામ પ્રશ્નોનો સમાધાન હલ થઈ શકે તેમ છે.

આજનું રાશિ ભવિષ્ય....

- | | | | |
|--|---|--|--|
| <p>મેષ (મ,લ,ઇ) :
આજના દિવસે લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. આજ ના દિવસે ભૂલી ને પણ કોઈ ને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળા થી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે? પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખજો. તમારા પ્રિયપાત્રની બાહોમાં તમને આરામ મળશે.</p> | <p>વૃષભ (બ,વ,ઉ) :
આજના દિવસે લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. માતા અથવા પિતા ની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે. આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધો માં મજબૂતી આવશે? દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યાં સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મુકશે.</p> | <p>કર્ક (ક,ઇ,ઘ) :
આજના દિવસે સ્વયં-સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે-તમને તમારી જાત માટે સાડું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. જે લોકો દુગ્ધ વેપાર થી સંકળાયેલા છે તે લોકો ને આજે લાભ થવા ની પ્રબળ શક્યતા છે. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન હુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો.</p> | <p>કર્ક (ક,ઇ,ઘ) :
આજના દિવસે આજે તમે સામાન્ય પણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો-વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા-થોડોક આરામ કરો તથા તમારી એપોઈન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો. આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે.</p> |
| <p>સિંહ (મ,ટ) :
આજના દિવસે ખાસ કરીને હૃદયરોગના દરદીઓએ કંફી છોડી દેવી. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારું વોલેટ ખોલાઈ જશે-બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. કુટુંબ ના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરી ને, તેમ હળવાશ અનુભવો છો, પરંતુ ઘણી વાર તમે તમારા અહમ ને આગળ રાખી ને તમારા પરિવાર ના સભ્યો ને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી.</p> | <p>કન્યા (પ,ઘ,ણ) :
આજના દિવસે મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થયી શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો.</p> | <p>તુલા (ર,ત) :
આજના દિવસે ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આપરે પરત મળશે. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન હુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો.</p> | <p>વૃશ્ચિક (ન,ય) :
આજના દિવસે તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તેમ ભયના ડરામણા ટ્રેન્ડ સામે લડી રહ્યા છો, અન્યથા તમે આ કફર ટ્રેન્ડના નિહિય તથા આસાન ભોગ બની જશો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે. તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો.</p> |
| <p>ધન (ભ,ધ,ફ) :
આજના દિવસે જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉધરાણી કરો-અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે. તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે.</p> | <p>મકર (મ,જ) :
આજના દિવસે તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અટકાવ સમય મળશે. તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમય માં તમને તકલીફ થયી શકે છે. જીવનસાથીને એચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલલ પહોંચી શકે છે, પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.</p> | <p>કુંભ (ગ,શ,સ) :
આજના દિવસે તમારી જાતને આજે તમે સામાન્ય પણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો-વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા-થોડોક આરામ કરો તથા તમારી એપોઈન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો. આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે.</p> | <p>મીન (દ,ચ,ઝ,થ) :
આજના દિવસે આજે તમે આશ્વાનાના જાદુઈ તબક્કા હેઠળ છો. તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમય માં તમને તકલીફ થયી શકે છે. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. આજે દુનિયા પ્રલયને કારણે કંદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો.</p> |

દહેજની સ્ટેલિંગ કંપનીમાં ગેસ ગળટરને લઈ અંભેટા ગામમાં નાસભાગ આરોગ્ય વિભાગને ઘટના સ્થળે પહોંચી અસરગ્રસ્ત લોકોની સારવાર માટે સૂચના અપાઈ

। કેતન મહેતા ભરૂચ, તા.૯ ।
દહેજ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ સ્ટેલિંગ ઓક્સિલરી કંપનીમાં ગેસ ગળટરની ઘટના બનવા પામી હતી. અંભેટા ગામના અનેક લોકોને ગેસની અસર થતા ખાંસી અને ગળામાં બળતરા થતા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ તેમજ GPCBની ટીમ ઘટના સ્થળે પહોંચી જરૂરી તપાસ કરી હતી. દહેજ ઈન્ડસ્ટ્રીઝમાં અકસ્માતો અટકવાનું નામ નથી લેતું ત્યારે અંભેટા અને જાગેશ્વર ગામની વચ્ચે આવેલ સ્ટેલિંગ ઓક્સિલરી કંપનીમાં ગેસ લીકેજ થતા કંપની સંકલ્પમાં અકસ્તાફરી મચી જવા પામી હતી. ગેસ ગળટરને પગલે અંભેટા ગામના અનેક લોકોને ગળામાં બળતરા તેમજ ખાંસીની સમસ્યા ઉદભવી હોવાની માહિતી મળી રહી છે. સુગ્રોની માહિતી મુજબ સલ્ફર ટ્રાયઓક્સાઈડ કંપનીમાં 503 ગેસ લીકેજ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો સલ્ફર ટ્રાયઓક્સાઈડ ગેસ લીકેજ થયો હોય તો તેના સંપર્કમાં આવવાથી માથાનો દુખાવો, ચક્કર, ઉબકા અને ઉલ્ટી થઈ શકે છે. બનાવને પગલે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગને ઘટના સ્થળે પહોંચી અસરગ્રસ્ત લોકોને સારવાર આપવા માટે સૂચના અપાઈ હતી. જ્યારે ગેસ ગળટરને લઈ GPCBની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે કોઈક જાનહાની નહિ થયાની માહિતી સાંપડી રહી છે.

વિશ્વ હિન્દુ પરિષદ, ભજરંગ દળ દ્વારા ગાંગરડી ગામે સત્સંગ કેન્દ્ર ચાલુ કરાવ્યું



। ઝાલોદ, તા.૯ ।
વિશ્વ હિન્દુ પરિષદ ભજરંગદળ દ્વારા ગાંગરડી ગામ મા આજરોજ બેઠક થઈ જેમાં સત્સંગ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું. આવનાર ઉત્સવ વિષય મા ચર્ચા થઈ પ્રખંડ સમિતિ પૂર્ણ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી જિલ્લા માંથી મનીષ ભાઈ પંચાલ સહ મંત્રી બળવંત ખોડ જિલ્લા ભજરંગદળ સંયોજક લોકેશ જી દવે સત્સંગ સંયોજક, અને પ્રખંડ મંત્રી ચિરાગ પંચાલ અને પ્રખંડ ભજરંગદળ સંયોજક દેવુસિંહ બામણીયા હેમંત ભાઈ હાજર રહ્યાં હતા.

છેવાડાના લોકો સુધીના કાર્યોમાં અગ્રેસર જસદણ ભાજપના યુવા સિનિયર અગેવાન અલ્પેશભાઈનો જન્મદિન



। જસદણ, તા.૯ ।
જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને રાજકોટ જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અલ્પેશભાઈ રૂપારેલિયા (મો. ૯૮૨૪૮૦૫૧૭૧) આજે સોમવારે પોતાની જીવનયાત્રાના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં તેમને વિવિધ માધ્યમો દ્વારા જન્મદિનની શુભેચ્છા મળી રહી છે રાજ્યીને શોભે એવી ભદ્રતા રાખનારા લેઉવા પટેલ સમાજના અલ્પેશભાઈ રૂપારેલિયા ભુતકાળમાં અઢી વર્ષ જસદણ નાગરિકોને સહભાગી બનાવનારા અલ્પેશભાઈ રૂપારેલિયાને ઘણું જીવે એવી શુભેચ્છા અને શુભકામનાઓ સોંપાઈ રહી છે.

૧૦ મી જુલાઈ : રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ લીંગડા મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્રમાંથી દર વર્ષે ૧૨ કરોડ જેટલી મીઠા પાણીની માછલીના બિયારણનું ઉત્પાદન થાય છે

૧૦ જુલાઈ ૧૯૫૭ ના રોજ ઓરિસ્સાના કટક રિસર્ચ સેન્ટર ખાતે ડો. હીરાલાલ ચૌધરી અને ડો. કે. એચ. અલીકુલ્હીએ મીઠા પાણીની માછલીઓના બિયારણનું સફળ પરીક્ષણ કર્યું હતું, જેના થકી મત્સ્યપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાઈ. આ નોંધપાત્ર સિદ્ધિને માન આપવા માટે ૨૦૦૧ ના વર્ષથી દર વર્ષે ૧૦ જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય પાલક દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ૧૦ મી જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય પાલક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે ગુજરાતના સૌથી પહેલા આણંદ જિલ્લાના મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્રની માહિતી વાંચકો માટે રસમ ડાળી રહેશે.
। આણંદ, તા.૯ ।
“ખેતી” શબ્દ સાંભળતાં જ આપણી સામે ખેતરોમાં લહેરાતા પાક અથવા તો ટ્રેક્ટર કે બળદની સાતીથી વાવણી કરી રહેલા ખેડૂતનું ચિત્ર ઉપસી આવે તે સ્વાભાવિક છે. પૌરાણિક કાળથી જ આપણે જમીનમાં બીજનું વાવેતર કરી ધાન પકવતા ખેડૂતોના વ્યવસાયને ખેતીકામ સાથે જોડી દિધો છે. પરંતુ ઝડપથી બદલાઈ રહેલા સમયમાં આજે ધાન્ય પાકોની ખેતીની સાથે હવે લોકો મત્સ્યપાલનની પ્રવૃત્તિ પણ ખેતીના એક ભાગ સ્વરૂપે અપનાવી મત્સ્યપાલનના વ્યવસાય થકી તેમના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યાં છે. ગુજરાતના આવા મત્સ્યપાલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને મીઠા પાણીની માછલીનું સાડું બિયારણ પ્રાપ્ત થાય તે માટે ૧૯૭૫-૭૬ ના વર્ષમાં સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ આણંદ જિલ્લાના લીંગડા ખાતે મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું. ૪૮ વર્ષની લાંબી સફર બાદ આજે આ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર ખાતેથી દર વર્ષે ૧૨ કરોડ જેટલી મીઠા પાણીની માછલીઓના સ્પોન મત્સ્ય બીજનું ઉત્પાદન કરી તેનું સમગ્ર ગુજરાતમાં વિતરણ કરવામાં આવે છે. રાજ્યમાં મત્સ્યોદ્યોગના ઝડપથી વિકસી રહેલા વ્યવસાય સાથે જોડાયેલા પરિવારો આર્થિક રીતે સક્ષમ બને તે માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. દરિયાઈ પટ્ટીનો વિસ્તાર ધરાવતાં આણંદ જિલ્લામાં મત્સ્યોદ્યોગનો ઘણો વિકાસ થયો છે. જિલ્લાના દરિયાને અડીને આવેલા વિસ્તારોમાં માછીમારી - મત્સ્યપાલનની પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા આ વિસ્તાર સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં થતી મત્સ્યપાલનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે અને તેની સાથે જોડાયેલા પરિવારોને મીઠા પાણીની માછલીનું સાડું બિયારણ પ્રાપ્ત થાય તે માટે રાજ્યમાં લીંગડા ઉપરોત્ત ઉકાઈ, પીપોદરા (સુરત), કોસમાળા (સુરત) અને પાલણ ખાતે મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના લીંગડા ખાતે સ્થાપાયેલા આ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્રની વિગતો આપતાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી આર.પી. સખરેલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનું સૌ પ્રથમ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર લીંગડા ખાતે

અમદાવાદ શહેરે પૈશ્વિક પર્યાવરણીય પહેલ - ‘સેવ અર્થ મિશન’ની ગ્રાન્ડ ટેક ઓફ ઇવેન્ટની મેજબાની કરી



। અમદાવાદ, તા.૯ ।
ભારતના માન્યેસ્ટર શહેર તરીકે ઓળખાતા અમદાવાદમાં ‘સેવ અર્થ મિશન’ની મહત્વપૂર્ણ ટેક-ઓફ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રાંતિકારી પહેલનો ઉદ્દેશ ગ્લોબલ ફાઉન્ડેશન શ્રી સંદીપ ચૌધરીની આગેવાની અંતર્ગત વિશ્વને સકારાત્મક પરિવર્તન પહોંચાડવા માટે તેના સમર્પિત પ્રોજેક્ટ્સ અને કારણોની વ્યાપક સૂચિનું અનાવરણ કરવાનો છે. આ ગાલા ઇવેન્ટમાં ૬૯ દેશોમાંથી લગભગ ૧૫૦૦ પ્રતિનિધિઓ ભાગ લીધો, જેઓ કોમર્સ, ઈન્ડસ્ટ્રી, ક્લિવેશરોપિસ્ટ, એન્વાયર્મેન્ટ, ડેવલોપમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. ‘સેવ અર્થ મિશન’ના યુનાઈટેડ આરબ અમીરાત (યુ.એ.ઈ.)માં શાસક પરિવારના સભ્ય શેખ માજિદ રશીદ અલ મુઅલ્લા અને યુનાઈટેડ સ્ટેટ્સમાંથી ઈન્ફલેક્ટરના સ્થાપક અને સંશોધક શ્રી ડેનિસ જોરોબર્ટસ સહિતના વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહેશે.

એટલું જ નહીં યુનાઈટેડ સ્ટેટ્સ જે કાર્યક્રમના સન્માનિત અતિથિનારૂપમાં સેવા આપશે. આ મેગા ટેક ઓફ ઇવેન્ટની વિશેષતા એ ઈન્ફલેક્ટર નામના રહસ્યમય સુપરહીરોનો પરિચય હશે જેનું મિશન પર્યાવરણનું રક્ષણ અને સંરક્ષણ કરવાનું છે. હજારો લોકોના જીવનમાં નમૂનારૂપ પરિવર્તન લાવવાના વિઝન સાથે સેવ અર્થ મિશનએ વૈશ્વિક સ્તરે સકારાત્મક અસર ઊભી કરવાના હેતુથી વિવિધ પહેલ અને સેવાઓનું આયોજન કર્યું છે.

મહારાષ્ટ્રમાં કેટલાક દિવસથી રાજકારણ ગરમાયું છે ઠાકરે-શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતા પર અધ્યક્ષની નોટિસ



મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકારણ ગરમાયું છે અને ભારે ઉથલાવણ જોવા મળી રહી છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ શિંદે અને ઉદ્ભવ ઠાકરે જૂથના ધારાસભ્યોને નોટિસ ફટકારી છે અને સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા કહેવાયું છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાઈકરે જણાવ્યું હતું કે શિંદેના નેતૃત્વ ધરાવતી શિવસેનાના ૪૦ ધારાસભ્યોને ઠાકરે જૂથના ૧૪ ધારાસભ્યોને અયોગ્યતા પર જવાબ માંગવા પર નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી મંડળ વિસ્તારની ચર્ચા છે અને માનવામાં આવી રહ્યું છે કે એનસીપી જૂથ સાથે આવતા શિવસેના શિંદે જૂથના ધારાસભ્યો નારાજ છે. મહત્વપૂર્ણ છે કે વિધાનસભા અધ્યક્ષ શિંદે જૂથના ૧૬ ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય કરવાનો છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં ગયા વર્ષે બળવો થયો હતો જે બાદ શિવસેના (શિંદેજૂથ)એ બીજેપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. જેના વિરુદ્ધમાં ઉદ્ભવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં દ્વાર ખટખટાવ્યા હતા. ઉદ્ભવ ઠાકરે જૂથે એકનાથ શિંદે અને તેમની સાથે ૧૫ ધારાસભ્યોને અયોગ્ય ઠેરાવવાની માગ ઉઠાવી હતી.

મુંબઈમાં કામચલાઉ પુલ ગુમ થઈ ગયો હતો ૬૦૦૦ કિલો લોખંડના પુલની કથિત ચોરી બદલ ઠની ધરપકડ

મુંબઈ પોલીસે શહેરના પશ્ચિમી ઉપનગરમાં નાળા પરના ૬,૦૦૦ કિલો લોખંડના પુલની કથિત રીતે ચોરી કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરી છે. બાંગુર નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મલાડ (વેસ્ટ)માં ૮૦ ફૂટ લાંબુ મેટલ સ્ટ્રક્ચર યુટિલિટી કંપની અદાણી ઈલેક્ટ્રીસિટી દ્વારા વિશાળ ઈલેક્ટ્રિક કેબલ પસાર કરવા માટે મુકવામાં આવ્યું હતું. નાળા પર કાચમી પુલ બનાવવામાં આવ્યા બાદ થોડા મહિના પહેલા જ કામચલાઉ પુલ આ વિસ્તારમાં બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, ૨૬ જૂને આ કામચલાઉ પુલ ગુમ થયો હતો, જેના પગલે વીજ કંપનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના કામદારો પર ચોરીનો આરોપ લાગ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, પુલને છેલ્લે ૬ જૂને જોવામાં આવ્યો હતો. સ્થળ પર કોઈ સીસીટીવી કેમેરા ન હોવાથી, પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા સર્વેલન્સ કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા અને ૧૧ જૂને એક મોટું વાહન પુલની દિશામાં જતું જોવા મળ્યું હતું, આ પછી, પોલીસે તેના રજીસ્ટ્રેશન નંબર પરથી વાહનને ટ્રેસ કર્યું.

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ વૈચારિક મતભેદોથી ભાજપ સાથે ચૂંટણી વાટાઘોટો પડી ભાંગી : NCP શરદ પવાર

શરદ પવારે કહ્યું કે તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને તેમની પાસે કોઈ મંત્રી પદ નથી

મુંબઈ, તા.૯ | મહારાષ્ટ્રમાં જ્યારથી અજિત પવારે બળવો કર્યો છે ત્યારથી રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે અને રોજ રોજ નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે હવે એનસીપીના વડા શરદ પવારે મીડિયા સાથેની વાતચીતમાં એક મોટું નિવેદન આપતા સ્વીકાર્યું હતું કે તેમણે ૨૦૧૪, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપ સાથે વાતચીત કરી હતી. જો કે વૈચારિક મતભેદોને કારણે વાતચીત આગળ વધી શકી ન હતી. અજિત પવારે એનસીપીમાં બળવો કર્યા બાદ શરદ પવાર પર નિવૃત્તિની ટિપ્પણી કરી હતી જેના જવાબમાં શરદ પવારે આજે કહ્યું કે તેઓ ૨૨ વર્ષની ઉંમરે પણ કામ કરી શકે છે. આ સાથે શરદ પવારે ભારપૂર્વક કહ્યું કે તેઓ 'હજી વૃદ્ધ નથી' અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી



વાજપેયીના શબ્દોનો ઉલ્લેખ કરતા કહ્યું, 'ના ટાયર્ડ હું, ના રિટાયર્ડ હું'. એનસીપીના વડાએ કહ્યું કે તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને તેમની પાસે કોઈ મંત્રી પદ નથી તેમજ મને નિવૃત્ત પવારે આજે કહ્યું કે તેઓ ૨૨ વર્ષની ઉંમરે પણ કામ કરી શકે છે. આ સાથે શરદ પવારે ભારપૂર્વક કહ્યું કે તેઓ 'હજી વૃદ્ધ નથી' અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી

પરંતુ મને નક્કી કર્યું હતું કે અમે વિચારધારા પર સહમત ન હોવાથી આમ ન કરવું જોઈએ. તેથી અમે ચર્ચા કરવામાં કંઈ ખોટું કર્યું નથી કારણ કે તે લોકશાહીની એક પ્રક્રિયાનો એક ભાગ છે. મહત્વની વાત એ છે કે હું ક્યારેય ભાજપ સાથે ગયો નથી. આ સાથે જ શરદ પવારે કહ્યું કે પરિવારમાં શું થયું તેની ચર્ચાને બહાર કરીશ નહીં. મને ખરાબ લાગ્યું કે એ બધા મારી નજીક છે પણ મને અગાઉ પણ આવી ઘટનાઓનો સામનો કર્યો છે. હું ફરીથી પાર્ટીને ઉભી કરીશ. તેમણે કહ્યું કે ચૂંટણી પંચમાં જે થાય છે તેનાથી કોઈ ફરક પડતો નથી, તે થતું રહેશે. હું જમીની સ્તરે કામ કરતો રહીશ. આ ઉપરાંત વિપક્ષનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમારો પ્રયાસ વિપક્ષી એકતા માટે છે. ચૂંટણી જીતશે તેની કોઈ ગેરંતી નથી પરંતુ તમારે વિચારધારાના મુદ્દે સાથે આવવું જોઈએ.

કોઈને પણ ગુફા તરફ નથી જવા દેવાતા ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા અટકી

નવી દિલ્હી, તા.૯ | ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને અનેક ઠેકાણે ભારે વરસાદ વરસી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાની ઘટનાઓ ઘટી રહી છે, જેના કારણે હવે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી મુદ્દ અધિકારીઓએ આપી છે. તેમને કહ્યું કે બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી મુસાફરોની અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે અમરનાથ યાત્રા સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવશે. કોઈને પણ ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી. અમરનાથ યાત્રા મુલતવી રાખવા અંગે અધિકારીઓએ કહ્યું કે, યાત્રા મોકૂફ રાખવામાં આવી છે અને આજે સવારે કોઈ પણ ભક્તને ગુફા તરફ જવાની મંજૂરી નથી. તેમને વધુમાં જણાવ્યું કે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે યાત્રા સ્થગિત થઈ ગઈ હતી. ભક્તોની અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ૨,૪૧૦ તીર્થયાત્રીઓને બાલતાલ અને નુનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા સવારે લગભગ ૪.૪૫ વાગ્યે જમ્મુના બેઝ કેમ્પથી ૭,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓનો નવો જથ્થો અમરનાથ યાત્રા માટે રવાના થયો હતો. અહીં ૬૬૬ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓ ૨૪૭ વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી ખીણ તરફ આગળ વધ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૪,૬૦૦ યાત્રાળુઓને લઈને ૧૫૩ વાહનોનો કાફલો પહેલગામ જઈ રહ્યો હતો, જ્યારે ૨,૪૧૦ શ્રદ્ધાળુઓને લઈને ૮૪ વાહનોનો બીજો કાફલો સવારે ૪.૪૫ વાગ્યે બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. આ વર્ષે ૩૦ જૂને અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી જમ્મુ બેઝ કેમ્પથી કુલ ૪૩,૮૩૩ શ્રદ્ધાળુઓ ખીણ તરફ રવાના થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૮૪,૦૦૦ને વટાવી ગઈ છે. દક્ષિણ કાશ્મીર સ્થિત ગુફા મંદિરની દર-દિવસીય વાર્ષિક તીર્થયાત્રા, અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લામાં બાલતાલ બંને માગોથી શરૂ થઈ હતી.



મોદી સરનેમ પરની ટિપ્પણી પર રાહુલને સખાનો કેસ રાહુલ ગાંધીના સમર્થનમાં ૧૨મીએ દેશભરમાં કોંગ્રેસનું મોન સત્યાગ્રહ

નવી દિલ્હી, તા.૯ | ગુજરાત હાઈકોર્ટે 'મોદી સરનેમ' પરની ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસને નકારી કાઢ્યા બાદ કોંગ્રેસે રાહુલ ગાંધી પ્રત્યે એકતા પ્રકટ કરતા ૧૨ જુલાઈના રોજે તમામ રાજ્યોમાં મોન સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું છે. આ સત્યાગ્રહ સવારે ૧૦:૦૦થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી રાજ્યના મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે યોજાશે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખો, રાજ્ય પ્રભારીઓ અને પાર્ટીના અગ્રીમ સંગઠનો અને વિભાગોના પ્રમુખોને પત્ર મોકલીને મોન સત્યાગ્રહના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. વેણુગોપાલે કહ્યું કે આ સમય એક સાથે મળીને બતાવવાનો છે કે સત્ય અને ન્યાયની લડાઈમાં રાહુલ ગાંધી એકલા નથી, પરંતુ લાખો કાર્યકરો અને કરોડો નાગરિકો તેમની સાથે ઉભા છે. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'મોદી સરનેમ' ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી છે. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ૨૩ માર્ચે ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણિમા મોદી દ્વારા ૨૦૧૯ના કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮ અને ૫૦૦ (ગુનાહિત માનહાનિ) હેઠળ રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા બે વર્ષની સજા કરી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ સમય એક સાથે મળીને બતાવવાનો છે કે સત્ય અને ન્યાયની લડાઈમાં રાહુલ ગાંધી એકલા નથી, પરંતુ લાખો કાર્યકરો અને કરોડો નાગરિકો તેમની સાથે ઉભા છે. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'મોદી સરનેમ' ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી છે. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ૨૩ માર્ચે ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણિમા મોદી દ્વારા ૨૦૧૯ના કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮ અને ૫૦૦ (ગુનાહિત માનહાનિ) હેઠળ રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા બે વર્ષની સજા કરી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ સમય એક સાથે મળીને બતાવવાનો છે કે સત્ય અને ન્યાયની લડાઈમાં

પોતાના પૈતૃક ગામના લોકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપી ઉદ્યોગપતિએ તેના ગામના દરેક લોકોને ૫૮-૫૮ લાખ આપ્યા

સુનિશ્ચિત, તા.૯ | એક ધનાઢ્ય ઉદ્યોગપતિએ પોતાના પૈતૃક ગામના લોકોને એવું સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક જ ઝટકામાં આખું ગામ સમૃદ્ધ થઈ ગયું હતું. ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ બની ગયો હતો. હવે ગ્રામજનો આ ઉદ્યોગપતિ પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે. પ્રોપર્ટી ડેવલપર બૂયોંગ ગ્રુપના સ્થાપક લી જોંગ ક્યુન દક્ષિણ કોરિયાના રહેવાસી છે. આ ૮૨ વર્ષીય ઉદ્યોગપતિએ સુનિશ્ચિત શહેરના નાના ગામ અનપ્યોંગ-રિના લોકોને લગભગ ૫૮-૫૮ લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. તેમણે ગામના વિદ્યાર્થીઓમાં ઈતિહાસના પુસ્તકો અને ટુલસેટનું વિતરણ પણ કર્યું હતું. મળેલા અહેવાલ મુજબ આ અનપ્યોંગ-રિના ગામમાં કુલ ૨૮૦ પરિવારો રહે છે. બૂયોંગ ગ્રુપના સ્થાપક જોંગે તેમના પરિવારોને ૫૮-૫૮ લાખ રૂપિયા આપ્યા છે. એટલું જ નહીં તેમણે તેમના સ્કૂલ સમયના મિત્રોને લાખો રૂપિયાની ભેટ પણ આપી છે. કુલ મળીને જોંગે ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. લોકો તેમની ઉદારતાના વખાણ કરી રહ્યા છે. જોંગની કંપની તરફથી જણાવવામાં આવ્યું કે આ પૈસા ગામના લોકોનું આભાર વ્યક્ત કરવા માટે આપવામાં આવ્યા છે. દાનની રકમ જોગના અંગત ભંડોળમાંથી આપવામાં આવી હતી. એક સમયે જોંગ ખુબ જ ગરીબીમાં રહેતો હતો, ત્યારે ગામના કેટલાક લોકોએ તેને ટેકો આપ્યો હતો. આવી સ્થિતિમાં હવે સક્ષમ બનીને તેમણે આભાર વ્યક્ત કરવા માટે રોકડડું વિતરણ કર્યું છે. જોંગે ૧૯૭૦ના દાયકામાં રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

વિશેષ લેખ

સાવધાન! વધતી જતી અસહ્ય ગરમી મોતની સજા બની શકે છે !

યુએસ નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શને ગરમી અંગેનો અહેવાલ બહાર પાડ્યો



સાંપ્રત પ્રવાહો લેખક : દીપક જગતાપ

ચોમાસુ આવી ગયું હોય, પણ મન મૂકીને વરસાદ પડતો નાં હોય. એકાદ સામાન્ય ઝાપટું પડ્યા પછી ઉકળાટ અને બાકનો અનુભવ થતો હોય ૨૪કલાક ચાલતા એસીનુંબીલ પણ વધતું જતું હોય ત્યારે અસહ્ય ગરમીથી ત્રાહિમામથઈ ગયેલા લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. હા, આ વખતે ૩ જુલાઈ ૨૦૨૩નો દિવસ સૌથી ગરમ દિવસ રહ્યો. પૃથ્વીનાં ઈતિહાસમાં અત્યાર સુધીનો આટલો ગરમ દિવસ ક્યારેય જોવા મળ્યો નથી. સોમવારે ધરતીનું સરેરાશ તાપમાન ૧૭.૦૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન માનવામાં આવી રહ્યું છે. યુએસ નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શને ગરમી અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. અને ચેતવણી આપી છે કે સાવધાન, વધતી જતી અસહ્ય ગરમી મોતની સજા બની શકે છે. પૃથ્વી પર ખોરવાતી જતી પરીઆવરણની અસમતુલાનું પરિણામ આજે માનવી ભોગવી રહ્યો છે. વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ અને જળવાયુ પરિવર્તનમાં બદલાવ આવવાના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતી જતી ગરમીના કારણે સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, વધતી ગરમી એ લોકો માટે મોતની સજા બની શકે છે.

અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. તે જ સમયે, દક્ષિણ અમેરિકા તાજેતરના અહવાલિયામાં તીવ્ર ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. આ સિવાય ચીનમાં પણ લોકો ઠીટ વેવનો સામનો કરી રહ્યા છે. અહીં તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. તે જ સમયે, ઉત્તર આફ્રિકામાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસની નજીક નોંધાયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સમયે એન્ટાર્ટિકામાં શિયાળાની મોસમ હોવી જોઈએ પરંતુ અહીં સામાન્ય કરતા વધારે તાપમાન નોંધાયું છે. આજેન્ટિનો ટાપુઓમાં યુકેનના વર્નાડસ્કી રિસર્ચ બેઝ તાજેતરમાં ૮.૭ ડિગ્રી સેલ્સિયસ સાથે તેનો જુલાઈ મહિનાના તાપમાનનો રેકોર્ડ તોડ્યો હતો. છેલ્લા ચાર દાયકામાં એવા દિવસોની સંખ્યા વધી છે કે જ્યારે તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હોય. બીબીસીએ નોંધ્યું છે કે ૧૯૮૦થી ૨૦૦૯ વચ્ચે વર્ષે સરેરાશ ૧૪ દિવસોમાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, આવા દિવસોની સંખ્યા ૨૦૧૦થી ૨૦૧૯ની વચ્ચે ૨૬ રહી હતી. આ સમયગાળામાં દર વર્ષે તાપમાન ૪૫ ડિગ્રી અને તેનાથી ઉપર નોંધાયું હતું. બ્રિટનના આબોહવા વિજ્ઞાની ફેડરિક ઓટ્ટોએ વધતા તાપમાન અંગે જણાવ્યું હતું કે, આ કોઈ માઈલસ્ટોન નથી જેને આપણે ઉજવીએ. આ લોકો માટે મોતની સજા બની શકે છે. તે જ સમયે, અન્ય વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ માટે કલાયમટ ચેન્જ જવાબદાર છે. સંશોધકો માને છે કે, અલ નીનો નામની કુદરતી હવામાન ઘટના અને માનવીઓમાંથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનનું મિશ્રણ ગરમીનું કારણ બની રહ્યું છે. વિધુવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થવાની ઘટનાને 'અલ નિનો' કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે તાપમાનમાં વધારાના તમામ કારણોમાં મોસમી પરિબળ 'અલ નિનો' પણ



મહત્વપૂર્ણ છે. જ્યારે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ ધ્રુવીય પ્રદેશોમાં સમુદ્રના મોટા ભાગની સપાટીનું તાપમાન વધે છે ત્યારે તેને અલ નીનો અસર કહેવાય છે. ક્યારેક આ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જાય છે. આ વધારાના તાપમાનને કારણે વાતાવરણમાં ગરમી વધે છે. અલ નીનો અસરવાળા વર્ષોમાં, આ ગરમીને કારણે, પૃથ્વીનું તાપમાન પણ વધે છે. અલ નીનો સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય પ્રદેશના હવામાનને અસર કરે છે. મુશળધાર વરસાદ જે સામાન્ય રીતે દક્ષિણપૂર્વ એશિયા અથવા પૂર્વ ઓસ્ટ્રેલિયામાં થાય છે તે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે આ અસરને કારણે થાય છે. આ ફેરફારને કારણે વિવિધ ખંડોમાં ઉષ્ણકટિબંધીય સ્થિતિ ઊભી થઈ શકે છે, ખાદ્ય ઉત્પાદનને અસર થઈ શકે છે અને ક્રિકેટ વગેરે જેવી આઉટડોર રમતોને પણ અસર થઈ શકે છે. આ ક્ષેત્રના હવામાનમાં થતા ફેરફારની અસર સમગ્ર વિશ્વ પર પડે છે. ઉત્તર યુરોપમાં પણ, હજારો કિલોમીટર દૂર, અલ નીનોના પ્રભાવને કારણે ઠંડા અને સૂકા શિયાળો અનુભવાય છે. તેમ છતાં, ત્યાં ઘણા પરિબળો છે જે યુરોપના હવામાનને અસર કરે છે, ખાસ કરીને

શિયાળામાં. આવી સ્થિતિમાં, યુરોપમાં સામાન્ય હવામાન પ્રવૃત્તિઓને અલ નીનો અસર સાથે જોડતી વખતે વધુ સાવચેત રહેવાની જરૂર છે. પેસિફિક મહાસાગર દક્ષિણ અમેરિકાના કિનારે તેની પૂર્વ ધારથી ઈન્ડોનેશિયામાં તેની પશ્ચિમી ધાર સુધી ૧૩,૦૦૦ કિલોમીટરથી વધુ વિસ્તરે છે. દરિયાની સપાટીનું તાપમાન આટલા લાંબા અંતર પર બદલાય છે. સામાન્ય રીતે, પેસિફિક મહાસાગરની પૂર્વ બાજુનું તાપમાન પશ્ચિમ બાજુના તાપમાન કરતાં સરેરાશ અથવા પાંચ ડિગ્રી ઓછું હોય છે. એટલે કે, પૂર્વ બાજુ પશ્ચિમ બાજુ કરતાં ઠંડી રહે છે. પૂર્વીય કિનારો ઠંડો રહેવાનું કારણ દક્ષિણ અમેરિકા નજીકના મહાસાગરમાં ઠંડા પાણીનું મિશ્રણ છે, જેની પ્રક્રિયામાં સમુદ્રની ઊંડાઈમાંથી ઠંડું પાણી સપાટી સુધી ખેંચાય છે જ્યારે, લા નીના અસર વિપરીત છે. આમાં દરિયાની સપાટીનું તાપમાન ઠંડું થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી લા નીના ઈફેક્ટનો આ વર્ષે અંત આવી રહ્યો છે. પશ્ચિમી ઉષ્ણકટિબંધીય પેસિફિક પ્રદેશનું તાપમાન પૃથ્વી પરના તમામ મહાસાગરો કરતા થોડું વધારે છે. જેના કારણે હવામાં ભેજનો સંચય થાય છે જેના કારણે વાદળો બને છે અને ભારે વરસાદ પડે છે. સૌથી વધુ તાપમાન ધરાવતા વિસ્તારમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે. અલ નીનો દરમિયાન દરિયાની સપાટીનું તાપમાન પ્રશાંત મહાસાગરના પૂર્વીય કિનારે ઊંચું હોવાથી તે પ્રદેશમાં વાદળોની રચના અને વરસાદની શક્યતા વધુ હોય છે. દરેક અલ નીનો અસર અલગ હોય છે. કેટલાકમાં, માત્ર પૂર્વીય પેસિફિક મહાસાગરનું તાપમાન વધે છે, જેમ કે ૧૯૮૭-૯૮માં થયું હતું. કેટલાક મધ્ય પેસિફિક મહાસાગરમાં તાપમાનમાં વધારો કરે છે જેમ કે ૨૦૦૯-૧૦માં થયું હતું. આ વધતી ગરમી પાછળનું મુખ્ય કારણ શું છે એની પણ વૈજ્ઞાનિકો ચર્ચા કરી રહ્યાં છે. બ્રિટનના

આબોહવા વિજ્ઞાની ફેડરિક ઓટ્ટોએ વધતા તાપમાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તે જ સમયે અન્ય વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ માટે કલાયમટ ચેન્જ જવાબદાર છે. સંશોધકો માને છે કે, અલ નીનો નામની કુદરતી હવામાન ઘટના અને માનવીઓમાંથી કારણ બની રહ્યું છે. એટલે સુધી કે એન્ટાર્ટિકા પોતાની ઠંડીની સીઝનમાં પણ મહત્તમ તાપમાન નોંધાવી ચૂક્યું છે. એન્ટાર્ટિકાના અર્જેન્ટાઈન આઈલેન્ડ પર રહેલા યુકેનના વર્નાડસ્કી રિસર્ચ બેઝ પર જુલાઈનું તાપમાન ૮.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે ખુબ જ વધુ છે. લંડન સ્થિત ઈમ્પીરિયલ કોલેજમાં ગ્રાંથમ ઈન્સ્ટીટ્યૂટ ફોર કલાઈમેટ ચેન્જ એન્ડ એનવાયરમેન્ટના વૈજ્ઞાનિક ફેડરિક ઓટ્ટોએ જણાવ્યું કે આપણે પ્રકૃતિ સાથે ખેલ ખેલી રહ્યા છીએ. તાપમાન સતત વધી રહ્યું છે. ફેડરિકે એમ પણ કહ્યું કે આ લોકો અને ઈકોસિસ્ટમ માટે મોતની સજાથી જરાય કમ નથી. આ જળવાયુ પરિવર્તનનું પરિણામ છે. આ સાથે આ વખતે અલ નીનોની અસર પણ જોવા મળી રહી છે. આ બંને પર જ આરોપ લાગી શકે છે. પરંતુ જવાબદાર તો માણસ જ છે. માર્ચમાં કલાઈમેટ ચેન્જ પરની ઈન્ટરગવર્નમેન્ટલ પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નજીકના ભવિષ્યમાં વૈશ્વિક તાપમાનમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ૨૦૩૫ સુધીમાં ૨૦૧૯ના સ્તરથી ૬૦% નીચે ઘટાડવું જોઈએ. બર્કલે અર્થના સાયન્ટિસ્ટ જે કે હોસફાઇરે કહ્યું કે જેટલું વધુ કાર્બન ઉત્સર્જન થશે તાપમાન એટલું જ વધશે. ઉત્સર્જન, ગ્રીનહાઉસ ગેસ અને અલ નીનોએ મળીને દુનિયાનો વધારો વધારી દીધો છે. સામાન્ય રીતે દુનિયાનું તાપમાન ૧૨થી ૧૭ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ફરતું રહે છે. પરંતુ આ હવે મહત્તમ સ્તરે છે.



રવિવારે પણ અમદાવાદના ઘણા વિસ્તારમાં વરસાદ થયો હતો.

ગુજરાતમાં છેલ્લા ૧૨ કલાકમાં ૨૩૧ તાલુકામાં વરસાદ થયો

અમદાવાદ, તા.૯ | રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાન વિભાગે હજુ આગામી ૨૪ કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૧૨ કલાકમાં ૨૩૧ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં સૌથી વધુ ૬-૫ ઈંચ વરસાદ, રાજકોટના કોટડા સાંગાણીમાં છ ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કચ્છના અખડાસમા પાંચ ઈંચ વરસાદ, દ્વારકાના બંભાળિયામાં

પણ દે ધનાધન પાંચ ઈંચ વરસાદ, રાજકોટના ઉપલેટામાં પણ પાંચ ઈંચ, જુનાગઢના વંથલીમાં ચાર ઈંચ વરસાદ, રાજકોટના ગોંડલમાં ૩.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. સવારથી જ પાટણ વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે. પાટણના સાંતલપુરમાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે. સાંતલપુર તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સાંતલપુરમાં છેલ્લા ૬ કલાકમાં ૬ ઈંચ વરસાદ ખાબકતા જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જો હજુ લાંબો સમય વરસાદ યથાવત રહેશે તો સ્થિતિ વણસી શકે છે. ભારે વરસાદથી નીચાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વારાહી પંથકમાં નીચાળા

વિસ્તારમાં પાણી ભરાયા છે. વારાહીના કાદીસરા તળાવ વિસ્તારમાં પાણી ભરાયા છે. તળાવનું પાણી બેક મારતા લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યું છે. હજુ પણ ધીમીધારે અવિરત વરસાદ યથાવત છે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સવારથી લઈને અત્યાર સુધીમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. હજુ પણ રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા ૯ વર્ષોમાં મોદી-શાહની જોડીએ એક પછી એક માસ્ટર સ્ટ્રોક લગાવ્યા

સંયુક્ત રાષ્ટ્રએ પણ માન્યું પીએમ મોદી અને શાહની જોડીનું ઉમદા કાર્ય, ભારતને મળી નવી ઓળખ

કાશ્મીરમાં બાળકોની સુરક્ષા માટે વધુ સારી કામગીરી કરવાને કારણે ભારત અપમાનજક (દાગી) દેશોની યાદીમાંથી થયું બહાર

અમદાવાદ, તા.૯ | છેલ્લા ૯ વર્ષથી મોદી-શાહની જોડી ભારતને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સફળ વ્યૂહરચનાનું પરિણામ છે કે, ૧૨ વર્ષના લાંબા અંતરાલ પછી પહેલીવાર ભારતનું નામ સંયુક્ત રાષ્ટ્રના 'વિલ્ડન એન્ડ આર્મ્ડ ક્રોન્કિલક્ટ રિપોર્ટ'માંથી હટાવવામાં આવ્યું છે. યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર) સ્વીકાર્યું છે કે, ભારત સરકારે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં "બાળકોને વધુ સારી રીતે સુરક્ષિત કરવા" માટે યોગ્ય પગલાં લીધાં છે. એક સમય હતો જ્યારે ભારતનું નામ બુર્કિના ફાસો, કેમરૂન, લેક ચાડ બેસિન, નાઈજીરિયા, પાકિસ્તાન અને કિર્ગિસ્તાન જેવા દેશોની સાથે 'બદનામ યાદી'માં સામેલ આવતું હતું. પરંતુ મોદી-શાહની જોડીએ આ અશક્યને પણ શક્ય કરીને બતાવ્યું છે. યુએનના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે 'વિલ્ડન એન્ડ આર્મ્ડ ક્રોન્કિલક્ટ રિપોર્ટ'ની નવી યાદીમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. બાળ અધિકારોના ઉલ્લંઘન અંગેના બનવાવાળા અહેવાલમાં જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ 'સંઘર્ષના ક્ષેત્ર' તરીકે કરવામાં આવતો હતો. આ વાર્ષિક અહેવાલ મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં બાળકો પર સશસ્ત્ર સંઘર્ષની અસર અને



વિવિધ દેશોમાં તેમના અધિકારોના ઉલ્લંઘન અંગે અહેવાલ આપવામાં આવે છે. અગાઉ, બાળકોની સુરક્ષા અને જમ્મુ અને કાશ્મીરમાં સશસ્ત્ર સંઘર્ષને કારણે, સંયુક્ત રાષ્ટ્રએ ભારતને 'દાગી' અને અપમાનિત દેશો'ની યાદીમાં મૂક્યું હતું. અનુચ્છેદ ૩૭૦ અને ૩૫૬ નાબૂદ થવાનું પરિણામ છે કે, ૨૦૧૦ પછી પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીર, કે જે યુએનની કલંકિત સૂચિમાંથી બહાર થયું છે, આજે જમ્મુ અને કાશ્મીર સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે. છેલ્લા ૯ વર્ષોમાં મોદી-શાહની જોડીએ એક પછી એક માસ્ટર સ્ટ્રોક લગાવ્યા છે, જેના પરિણામે જમ્મુ-કાશ્મીરને મુખ્ય પ્રવાહમાં લાવવાનો તેમનો આ પ્રયાસો સફળ થતો જોવા મળી રહ્યો છે. કલમ ૩૭૦ હટાવીને જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવનાર મહેનતુ નેતા અમિત શાહે જ્યારે સંસદમાં તેનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તમામ વિરોધ પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધીઓ કહેતા હતા કે 'કલમ ૩૭૦ નાબૂદ થયા પછી કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે.'

અસહ્ય ઠંડીનો સામનો ન કરી શક્યા

અમરનાથની યાત્રા દરમિયાન એક ગુજરાતી વ્યક્તિનું મોત નિપજ્યું હતું

વડોદરા, તા.૯ | હાલમાં અમરનાથ યાત્રા ખરાબ વાતાવરણને કારણે અટકાવી દેવામાં આવી છે. ત્યારે બાબા અમરનાથની યાત્રાએ ગયેલા શહેરના વેમાલી ગામના માજી પંચાયત સત્ય રાજેન્દ્ર ભાટીયા અસહ્ય ઠંડીનો સામનો ન કરી શકતા મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરાના વેમાલી ગામમાં રહેતા રાજેન્દ્રભાઈ મોહનભાઈ ભાટીયા અમરનાથ યાત્રામાં ગયા હતા. તેઓની સાથે વેમાલી ગામમાં રહેતા રમણભાઈ પરમાર તેમજ હોમગાર્ડમાં ફરજ બજાવતી બે મહિલાઓ અને દુમાડ ગામના એક યાત્રાળુઓ પણ બાબા અમરનાથના દર્શનને ગયા હતા. વેમાલી ગામના માજી સરપંચ રાજેન્દ્રભાઈ ભાટીયા સહિત તેઓની બસના યાત્રિકો પહેલગાંથી બાબાની ચુકા તરફ યાત્રા શરૂ કરી દીધી હતી. પરંતુ, વાતાવરણ સારું ના હોવાથી યાત્રિકોને પંચતરણી ખાતે રોકી દેવામાં આવ્યા હતા. પંચતરણીમાં ભારે વરસાદ અને માઈનસ ડિગ્રી ઠંડી હોવાથી અનેક યાત્રિકોથી ઠંડી સહન ન થતાં બીમાર પડવાનું શરૂ થયું હતું. જેમાં વેમાલી ગામના રાજેન્દ્રભાઈ ભાટીયાની તબિયત બગડતા તેમનું મોત નીપજ્યું હતું.



યાત્રીકોથી ઠંડી સહન ન થતાં બીમાર પડવાનું શરૂ થયું હતું

અમરનાથ યાત્રા દરમિયાન મોતને ભેટ્યા રાજેન્દ્રભાઈ ભાટીયા વેમાલી ગામમાં સહુન ચલાવતા હતા. ઉપરાંત તેઓ છેલ્લા કેટલાંક વર્ષથી હોમગાર્ડમાં પણ સેવા આપતા હતા. રાજેન્દ્રભાઈને પરિવારમાં પત્ની, બે દીકરી અને એક પુત્ર છે. ઉપરાંત ભાઈ-ભાણી સહિતનો બહેનો પરિવાર છે. વેમાલીના નિલેશભાઈ પટેલે જાણવ્યા અનુસાર રાજેન્દ્રભાઈ ભાટીયાનું મોત થતાં તેમનો મૃતદેહ પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવશે. જે માટેની તેજારીઓ હાથ ધરવામાં આવી છે. હાલમાં બાબા ભરફનીની યાત્રાને ખરાબ હવામાનને કારણે સંભાવી દેવામાં આવી છે. ત્યારે યાત્રામાં ઉપર પહોંચેલા યાત્રાળુઓને ટેન્ટમાં રોકી દેવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાંથી ૧૦ સુરતના અને ૨૦ વડોદરાના યાત્રાળુઓ ત્રણ દિવસથી ટેન્ટમાં ફસાયા છે. ભરફ અને વરસાદ પડવાને કારણે તેમના ગરમ કપડા સહિતનો સામાન પલળી ગયો છે. ત્યારે યાત્રાળુએ વીડિયો બનાવી તેઓને ત્યાંથી બહાર કાઢવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.

આટકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થા

શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં ઉજવાયો સ્ટુડન્ટ ઓફ ધ યર ૨૦૨૩ કાર્યક્રમ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ, તા.૯ | શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ સંસ્થા કે જે જસદણના આટકોટમાં આવેલી છે જ્યાં બી.કોમ./બી.સી. એ. અને બી.એ. જેવા કોર્સ ચાલી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં ટોપ શ્રી તથા સમગ્ર યુનિવર્સિટીમાં ટોપ ટેનમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનું વાલીની સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર ભરતભાઈ બોધરા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશભાઈ ભીમાણી રહ્યા હતા. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ભરતભાઈ બોધરાએ તમામ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી દૂર રહી કારકિર્દીમાં ધ્યાન



આપવા માટેની પ્રતિજ્ઞા પણ લેવાયી હતી. ડો. ગીરીશભાઈ ભીમાણીએ વિદ્યાર્થીઓને યુવાન કેવો હોવો જોઈએ તથા વિદ્યાર્થી અવસ્થામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવ્યું હતું. કમલેશભાઈ હિરપરાએ વિદ્યાર્થીઓને આગામી કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી. કોલેજના કો-ડાયરેક્ટર કેવલભાઈ હિરપરાએ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. કોલેજના તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને "નેવર ગીવ અપ" થીમ અંતર્ગત નિષ્ફળતામાંથી સફળતા પ્રાપ્ત કરેલ મહાનુભાવોનો વિગતે પરિચય આપ્યો હતો.

રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનો અટવાયા

ખંભાળિયામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો; જનજીવન પ્રભાવિત ખંભાળિયા શહેરને જોડતા મુખ્ય માર્ગ પર ફરી વળ્યા પાણી

દ્વારકા, તા.૯ | ખંભાળિયામાં બે કલાકમાં ખાબકેલા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના લીધે જનજીવન પ્રભાવિત થયો છે. ભારે વરસાદને પગલે ખંભાળિયા શહેરના રામનાથ સોસાયટીમાં પાણી ભરાયા છે. ખંભાળિયા શહેરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ચારે તરફ પાણી ફરી વળતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો અટવાયા છે. વરસાદના બીજી રાઉન્ડમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. આવમાં છેલ્લા ૮ કલાકમાં ૧૮૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સાંતલપુરમાં ૬, અખડાસામાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાળિયા, રાપરમાં ૩-૩ ઈંચ

આરોપીએ બાઇકની ચોરી કરી

રાજસ્થાનમાં બીમની દાટ્યું | અમદાવાદ, તા.૯ | અમદાવાદ શ્રામ્યમાં આવેલ અસલાલી પોલીસને એક સફળતા હાથ લાગી છે. જેમાં બાઈક ચોરીના ગુનામાં ફરાર એક આરોપીની બાઈક સાથે ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, અસલાલી વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલી બાઈકને આરોપીએ એવી જગ્યા છુપાવી દીધી હતી.

આજથી ધો.૧૦-૧૨ બોર્ડના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા

ગીર સોમનાથ, તા.૯ | અમદાવાદ, તા.૯ માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આવતીકાલ (સોમવાર)થી ૧૪ જુલાઈ સુધીમાં જુદા જુદા વિષયોની

Advertisement for SICS and SHALBY hospitals. It features a heart diagram and lists services like 'સેકન્ડ ઓપિનિયન ક્લિનિક' and '10 થી 15 જુલાઈ, 2023' with prices for various treatments.

Advertisement for IRIS HOSPITAL. It highlights 'સંપૂર્ણ મણકાની સારવાર માટે એકમાત્ર સ્થળ' and 'IRIS HOSPITAL'. It lists Dr. Dipak Shah (Spine Surgeon) and Dr. Amit Patel | Dr. Setul Patel, along with contact information and the hospital address in Anand.

Advertisement for 'વોટર પ્રુફીંગ સ્પેશ્યાલિસ્ટ'. It offers services like 'ધાબાનું લિકેજ અને ભેજનું કામ કરાવો' and 'વોટર પ્રુફીંગ કરવામાં આવશે' with contact numbers 9879750156 and 9998650156.